

## કળશ અમૃતના ...

સમયસાર કળશ-ગુજરાતી પદ્યાનુવાદ

જીવ-અજીવ અધિકાર

(દોહા)

નિજ અનુભૂતિથી પ્રગટ, ચિત્સ્વભાવ ચિદ્રૂપ,  
સકલ જ્ઞેય જ્ઞાયક નમૂં, સમયસાર સદ્રૂપ. ૧

(સોરઠા)

દેખે પરથી ભિન્ન, અગણિત ગુણમય આતમા,  
અનેકાન્તમયમૂર્તિ, સદા પ્રકાશિત રહે. ૨

(ગઝલ)

ભલે છું માત્ર શુદ્ધ જ હું વળી ચૈતન્યની મૂર્તિ,  
પરંતુ મેલી થઈ મારી પરિણતિ મોહના બળથી;  
પરમવિશુદ્ધિને પામો હવે તે પરિણતિ મારી,  
આત્મખ્યાતિ નામક આ ટીકાથી સમયસાર તણી. ૩

નયો બન્નેમાં જે વિરોધ છે તેના વિનાશક જે,  
વચન જિનવર તણા સ્યાહવાદમયમાં જે રમે નિત્યે;  
વમીને મોહને જાતે કરે કેલી તત્કાળે,  
પરમજ્યોતિ સમયસારે ન ખંડિત થાય જે કુનયે. ૪

અરે ! જયમ હસ્ત અવલંબન બને છે લાઠી દુર્બળને,  
ગણો વ્યવહાર ઉપયોગી, નથી પામ્યા પરમપદ જે;  
નહીં ઉપયોગી કિંચિત પણ સદા એવા જીવો સૌને,  
રમે છે જે પરમ-અર્થે વળી ચિન્મય ને ચિદ્ધને. ૫

(હરિગીત)

એકત્વમાં જે નિયત, વળી જે વ્યાપ્ત છે નય શુદ્ધથી,  
આ જ્ઞાનનો ઘનપિંડ પૂરણ પૃથક છે પરદ્રવ્યથી;  
નવતત્ત્વની પરિપાટી છોડી એક બસ તે પ્રાપ્ત હો,  
દર્શન કહ્યું તેને નિયમથી આતમાનું જ્ઞાણને. ૬

(દોહા)

શુદ્ધનયાશ્રિત આતમાં, પ્રગટે જ્યોતિસ્વરૂપ,  
નવતત્ત્વોમાં વ્યાપ્ત પણ તજે ન એકસ્વરૂપ. ૭

(ગઝલ)

છૂપાયું જેમ શુદ્ધકનક ઘણાં વર્ણો તણા ભેદે,  
છૂપાઈ આત્મજ્યોતિ આ નવે તત્ત્વો મહીં જ અરે;  
પ્રકાશે એકરૂપે તે બધા ભાવોથી ભિન્નપણે,  
અરે ભવ્યો ! જુઓ જ્ઞાણો સદા તેને પદે જ પદે. ૮

નહીં જન્મે નયો વળી ક્યાંય નિક્ષેપો બધા નાસે,  
ન જ્ઞાણે કેમ રે ભાઈ ! પ્રમાણ જ અસ્તને પામે;  
અરે ! કો ભાવ દ્વૈત તણા નહિ ત્યારે જ ત્યાં ભાસે,  
અખંડિત એક આત્માનો અનુભવ થાય છે જ્યારે. ૯

(હરિગીત)

પરભાવથી જે ભિન્ન છે વળી આદિ-અંત વિમુક્ત છે,  
સંકલ્પ તેમ વિકલ્પની જંજળથી પણ મુક્ત છે;  
જે એક છે, પરિપૂર્ણ છે - એવા નિજાત્મસ્વભાવને,  
કરતો પ્રકાશિત પ્રગટ આંહી શુદ્ધનય આ થાય છે. ૧૦

(હરિગીત)

પામે નહિ જેમાં પ્રતિષ્ઠા લેટી રહે બસ બાહ્યમાં,  
આ બદ્ધસ્પૃષ્ટાદિ બધાં જેના ન અંતરભાવમાં;  
જે છે પ્રકાશિત સર્વવિધ તે એક આત્મસ્વભાવનો,  
હે પ્રાણીઓ! આ જગતના નિર્મોહ થઈ અનુભવ કરો. ૧૧

(ગઝલ)

કરે જે નાશ મોહ તણો પુરૂષત્વે સુબુદ્ધિએ,  
નિરખી ત્રણ કાળના કર્મો તણા બંધોથી ભિન્નપણે;  
લહે તે આતમા નિશ્ચલ સદા શાશ્વત મહિમાવંત,  
વિરાજે પંક વિરહિત દેવ જે નિત્યે જ વ્યક્તપણે. ૧૨

અનુભૂતિ કહી આ આતમાની શુદ્ધનય જે રૂપ,  
વળી અનુભૂતિ જ્ઞાનની તે જ તેને જાણજે બંધુ !  
કરી નિશ્ચલપણે સ્થાપિત આતમાને જ આત્મમહી,  
નિરખજે જ્ઞાનઘન ને નિત્ય તે આતમા સદા સર્વે. ૧૩

મીઠાની કાંકરી બહુ ક્ષારરસથી જયમ ભરેલી છે,  
ભરેલો જ્ઞાનરસથી પૂર્ણ તેમજ આતમા મુજ છે;  
અનાકુળ ને અવિનાશી સહજ ઉલ્લાસથી વિલસે,  
સદા તે તેજમય ચિન્મય અખંડિત પ્રાપ્ત હો અમને. ૧૪

(હરિગીત)

છે સિદ્ધિની જો કામના તો ચિત્તના ભરમાવશો,  
આ જ્ઞાનનો ઘનપિંડ ચિન્મય આતમા અપનાવજો;  
બસ સાધ્ય-સાધક ભાવથી તે એકલાને ધ્યાવજો,  
પર્યાયમાં પરમાત્મા બંધુ! તમે પછી થઈ જાજો. ૧૫

જશો

(હરિગીત)

દગ જ્ઞાન ને ચારિત્રથી મેચક કહ્યો આ આતમા,  
બસ છે અમેચક તે સ્વયંથી આતમા પરમાતમા;  
પરમાણથી મેચક-અમેચક એક સમયે તે અહો,  
જિનવર કથન આ મર્મભેદી ને અલૌકિકને શ્રહો. ૧૬.

છે આતમા આ એક તોયે જાણ નય વ્યવહારથી,  
ત્રૈરૂપતા ધારણ કરે સદ્જ્ઞાન દર્શન ચરણથી;  
બસ એટલે મેચક કહ્યો છે આતમા જિનમાર્ગમાં,  
નહિ જાણતો તે જગતજન લાગે નહીં સન્માર્ગમાં. ૧૭.

મેચક કહ્યો છે આતમા આ યદપિ નય વ્યવહારથી,  
પણ તે નથી મેચક, અમેચક જાણ તું પરમાર્થથી;  
છે પ્રગટ જ્ઞાયક જ્યોતિમય તે એક છે ભૂતાર્થથી,  
છે શુદ્ધ એકાકાર પરથી ભિન્ન છે પરમાર્થથી. ૧૮

મેચક-અમેચક આતમાના ચિંતવનથી લાભ ના,  
બસ હો ! હવે સૌ તે વિકલ્પો જેથી કંઈપણ સાધ્ય ના;  
છે સાધ્યસિદ્ધિ એક બસ સદ્જ્ઞાન દર્શન ચરણથી,  
પથ અન્ય કોઈ છે નહીં જેથી બચો સંસરણથી. ૧૯

ત્રૈરૂપતાને પ્રાપ્ત પણ જે ના તજે એકત્વને,  
આ શુદ્ધ નિર્મળ જ્ઞાનજ્યોતિ પામી છે જે ઉદયને;  
કરીએ અમે અનુભવ સદા ચૈતન્યમય એ જ્યોતિનો,  
નહિ નહિ કદાપિ અન્યથા છે સાધ્યની કો સિદ્ધિ જો. ૨૦

(ગઝલ)

કરે જે પ્રાપ્ત પોતાથી જ અથવા અન્ય ઉપદેશે,  
અનુભૂતિ અવિચળને મૂળે વિજ્ઞાન છે જેને;  
પ્રતિબિંબો અનંતા જ્ઞાનમાં એના ભલે ભાસે,  
રહે દર્પણ તણા ન્યાયે અવિકારી જ તે નિત્યે. ૨૧

(હરિગીત)

અનાદિકાલીન મોહને હે જગતજન ! સૌ છોડજો,  
જે રસિકજનને બહુ રૂચે તે જ્ઞાનનો રસ ચાખજો;  
પામે નહિ તાદાત્મ્ય કો રીત આતમા પરદ્રવ્યથી,  
પામે નહિ અન્યત્વ કદી આ આતમા નિજ આત્મથી. ૨૨

કૌતૂહલી નિજ તત્વનો પાડોશી બન દેહાદિનો,  
તજવું પડે તન તોય તું ! કરજો અનુભવ આત્મનો;  
દેખીશ આત્મવિલાસને પરદ્રવ્યથી જ્યારે જુદો,  
તુરત તજીશ તું મોહને દેહાદિના એકત્વનો. ૨૩

હરી રૂપથી જનમોહને, નિજતેજથી રવિતેજને,  
નિર્મળ કરે નિજ કાંતિમય તનતેજથી દશ દિશને;  
ને દિવ્યધ્વનિથી ભવ્યજનના કર્ણમાં અમૃત ભરે,  
છે વંદનીય જિનેશ્વરો જે અઠસહસ લક્ષણ ધરે. ૨૪.

પ્રાકારથી કવલિત કરે જે નગર આ આકાશને,  
વળી ગોળ ને ગંભીર ખાઈથી પીવે પાતાળને;  
ઉપવન તણા સૌંદર્યથી જે ઢાંકતું ભૂમિ સર્વને,  
અદ્ભૂત અનુપમ તે નગર સંસારથી સૌ અલગ છે. ૨૫

ગંભીર સાગરના સમાન મહાન માનસ મંગમય,  
 છે નિત્ય નિર્મળ નિર્વિકારી સુવ્યવસ્થિત અંગમય;  
 છે સહજ જે અદ્ભૂત અનુપમ અપૂરવ લાવણ્યમય,  
 જ્યવંત વર્તે રૂપ જિનનું ક્ષોભવિરહિત દિવ્યમય. ૨૬

આ દેહ ને આત્માતણું એકત્વ બસ વ્યવહારથી,  
 આ શરીર આશ્રિત સ્તવન પણ તેથી કહ્યું વ્યવહારથી;  
 પરમાર્થથી તો ભિન્ન છે આ દેહ ને ચૈતન્યધન,  
 પરમાર્થથી તેથી સ્તવન ચિદ્ભાવનું બસ અનુભવન. ૨૭

આ દેહ ને આત્માતણા એકત્વને નયચુકિતથી,  
 દૂરે કર્યું જડમૂળથી મુનિએ પરિચિત તત્ત્વથી;  
 તો જે રસિલા નિજના વળી વેગથી આકૃષ્ટ હો,  
 ભાવોલ્લસિત આત્માર્થીઓને નિયમથી સદ્બોધ હો. ૨૮

પરભાવના પરિત્યાગની દષ્ટિ પુરાણી થાય ના,  
 વળી જ્યાં સુધી વૃત્તિ પ્રવૃત્તિ વેગવંતી થાય ના;  
 વ્યતિરિક્ત જે પરભાવથી થાયે વળી તે જીવની,  
 પ્રગટી અનુભૂતિ સ્વયં ચૈતન્યની તત્કાળથી. ૨૯

છું સર્વતઃ ચૈતન્યમય નિજભાવથી ભરપૂર હું,  
 તેથી સ્વયં આ લોકમાં નિજભાવનો અનુભવ કરું;  
 આ મોહ મારો નથી નથી, ચૈતન્યનનો ધનપિંડ છું,  
 છું શુદ્ધ ચિદ્ધનનો નિધિ, હું સ્વયં એક અખંડ છું. ૩૦

(હરિગીત)

થઈ અન્યભાવોથી બધાં આ રીત જ્યારે ભિન્નતા,  
સ્થાપિત કરી સ્વયમેવ ઉપયોગે સ્વયંથી ઐક્યતા;  
પ્રગટિત થયો પરમાર્થ ને દગ જ્ઞાન વ્રત પરિણત થયો,  
આ આતમા ત્યારે સ્વરૂપમાં બસ રમણરૂપ થઈ રહ્યો. ૩૧

છે શાંતરસથી બહુ ભર્યો આ જ્ઞાનસાગર આતમા,  
વિભ્રમ તણી ચાદર હટ્યે સર્વાંગ પ્રગટે આતમા;  
હે ભવ્યજન ! બસ એક સાથે સ્નાન કરજો સૌ તમે,  
અપનાવજો એને જ એમાં મગન બનજો સૌ તમે. ૩૨

(સવૈયા એકત્રીસા)

જીવ અને અજીવના વિવેકથી પુષ્ટ છે જે,  
એવી દ્રષ્ટિ દ્વારા આવા નાટકને દેખતો;  
અન્ય જે સભાસદ છે તેઓને દેખાડતો ને,  
દુષ્ટ અષ્ટ કર્મોના બંધનને જે તોડતો;  
જાણે લોકાલોક અને નિજમાં મગન રહે,  
વિકસિત શુદ્ધ નિત્ય નિજ અવલોકતો;  
એવો જ્ઞાનવીર ધીર મંગ ભરે મનમાં ને,  
સ્વયમ્ ઉદાત્ત વળી અનાકુળ શોભતો. ૩૩

(હરિગીત)

સિલાહાળ પદી,

હે ભવ્યજન ! શું લાભ છે આ વ્યર્થના બંધનથી,  
થોભો હવે જાણો સ્વયં અધ્યાત્મના અભ્યાસથી;  
જો અનવસ્ત ષટ્માસ હો નિજ આતમાની સાધના,  
તો આતમાની પ્રાપ્તિ હો તેમાં જરા સંદેહ ના. ૩૪

સિલાહાળ પદી,

(હરિગીત)

ચૈતન્યશક્તિથી રહિત પરભાવ સૌ પરિહારીને,  
ચૈતન્યશક્તિથી સહિત નિજભાવ નિત અવગાલીને;  
છે શ્રેષ્ઠતમ જે વિશ્વમાં સુંદર સહજ શુદ્ધાતમા,  
તેને તમે જ અનુભવો સૌ, સ્વયં હે ભવ્યાતમા. ૩૫

(દોહા)

ચેતન જેનો સાર છે, કેવળ તે છે જીવ;  
તે સૌ છોડીને બધાં, પુદ્ગલમયી અજીવ. ૩૬

વર્ણાદિક રાગાદિ સૌ, છે આત્માથી ભિન્ન,  
અંતર્દષ્ટિથી જુઓ, દીસે એક ચિદ્બિંબ. ૩૭

જે વસ્તુથી જે બને, તે તેનાથી ન અન્ય,  
સ્વાર્ણમ્યાન તો સ્વર્ણ છે, અસિ તેનાથી અન્ય. ૩૮

વર્ણાદિક જે ભાવ છે, તે સૌ પુદ્ગલજન્ય,  
એક શુદ્ધ વિજ્ઞાનઘન આતમ તેથી અન્ય. ૩૯

કહેવાથી ધીનો ઘડો, ઘડો ન ધીમય હોય,  
કહેવાથી વર્ણાદિમય, જીવ ન <sup>લો-મય</sup> ~~સિ-મય~~ હોય. ૪૦

સ્વાનુભૂતિમાં જે પ્રગટ, અચળ અનાદિ અનંત,  
સ્વયં જીવ ચૈતન્યમય, ચક્ર<sup>૨</sup>કાટ અત્યંત. ૪૧



(હરિગીત)

વર્ણાદિસહિત રહિત બે રીત એમ દ્રવ્ય અજીવ છે,  
તેથી ન જાણી શકાય જીવને અમૂર્તિક લક્ષણ વડે.  
ચેતનપણું લક્ષણ કહે વસ્તુસ્વરૂપ વિવેચકો,  
અતિવ્યાપ્તિ અણવ્યાપ્તિ રહિત નિર્દોષ તેને જાણજ્ઞે.  
અવલંબજ્ઞે અવિલંબ એવા અચળ આત્મસ્વભાવને,  
છે પ્રગટ તે, પ્રગટાવશે જ યથાર્થ જીવસ્વરૂપને. ૪૨

પૂર્વોક્ત લક્ષણથી જુદું છે અજીવ આ રીત જીવથી;  
તેથી વિલસતું ભિન્ન તેને જ્ઞાની જાણે જીવથી,  
તોપણ અરે અજ્ઞાનીજનનો નિરવધિ વ્યામોહ આ,  
કાં નાયતો રહેતો સદા તે ખેદ ને અચરજ મહા ! ૪૩

અનાદિકાલિનના મહા અવિવેકના આ નૃત્યમાં,  
બસ એક પુદ્ગલ નાયતું ચેતન નહીં આ કૃત્યમાં;  
આ જીવ તો પુદ્ગલમયી રાગાદિથી પણ ભિન્ન છે,  
આનંદમય ચિદ્ભાવ તો દગજ્ઞાનમય ચૈતન્ય છે. ૪૪

અનવરત કરવત જ્ઞાનની ચાલી રહે જ્યાં આ રીતે,  
ત્યાં જીવ તેમ અજીવમાં અતિવિકટ વિઘટન થઈ રહે;  
નહિ થાય જીવ અજીવ બન્ને ભિન્ન ભિન્ન પ્રગટપણે,  
અતિ વેગીલી ચિત્શક્તિથી જ્ઞાયક સ્વયં પ્રગટી રહે. ૪૫

શ્રીમદ્ભગવદ્ગીતા સર્ગ ૧૦મો અધ્યાય ૪૨-૪૫

## કળશ અમૃતબા ...

સમયસાર કળશ-ગુજરાતી પદ્યાનુવાદ

કર્તા-કર્મ અધિકાર

(હરિગીત)

હું એક કર્તા આતમા ક્રોધાદિ સૌ મારાં કરમ,  
પ્રવૃત્તિ કર્તા-કર્મની આવી કરે અજ્ઞાનીજન;  
શમાવતી બહુવિધ એને જ્ઞાનજ્યોતિ પાવની,  
અતિધીર પરમોદ્દેત પ્રગટી સર્વલોક પ્રકાશતી. ૪૬

પરપરિણતિને છોડતી વળી તોડતી સૌ ભેદભ્રમ,  
આ જ્ઞાનની જ્યોતિ અહો પ્રગટી અખંડ અને પ્રચંડ;  
કરતા-કરમ પ્રવૃત્તિને આ હોય ત્યાં અવકાશ ક્યાં ?  
વળી બંધ પુદ્ગલકર્મનો કાં હોય જગી જ્યોતિ જ્યાં ? ૪૭

આ રીત વિધિ પૂર્વોક્તથી નિર્વતી સૌ પરદ્રવ્યથી,  
વિજ્ઞાનધન નિજ ભાવ પર આરૂઢ થતો તત્કાળથી;  
નિવૃત્ત થઈ અજ્ઞાનમય કર્તા-કરમના કલેશથી,  
પુરાણ પુસ્તક પ્રકાશતો થઈ સાક્ષી જગનો આહીંથી. ૪૮

(દોહરા)

વ્યાપક-વ્યાપ્તપણું સદા તત્ત્વસ્વરૂપમાં હોય,  
પણ અતત્ત્વસ્વરૂપમાં તે ન કદાપિ હોય;

<sup>૫</sup>  
 વ્યાપક-વ્યાપક ભાવનો અભાવ હોય જહાં,  
 કર્તા-કર્મ તણી સ્થિતિ બની શકે ન તહાં.  
 આવો પ્રબળ વિવેકરૂપ જ્ઞાનપ્રકાશ મહાન,  
 કર્તા-કર્મપણા તણું ભેદે અઘઅજ્ઞાન;  
 જ્ઞાની આમ થયો થકો બની કર્તૃત્વરહિત,  
 શોભે છે આ આતમા નિજ આનંદસહિત. ૪૯

(હરિગીત)

નિજ-પર પરિણતિ જાણતો જ્ઞાની પ્રવર્તે છે સદા,  
 નિજ-પર પરિણતિ જાણતું પુદ્ગલ નહિ વર્તે કદા;  
 અત્યંત આવો ભેદ તેથી વ્યાપ્ય-વ્યાપક નવ બને,  
 'કર્તા-કર્મ અન્યોન્યના છે' - એમ મત મિથ્યા ઠરે;  
 ભ્રમબુદ્ધિ કર્તા-કર્મની બસ ત્યાં લગી જ રહે ખરે,  
 જ્યોતિ ન જાગે ભેદજ્ઞાન તણી અરે નિષ્ક્રપણે. ૫૦

જે પરિણામે કર્તા જ તે, પરિણામ તેનું કર્મ છે,  
 છે પરિણતિ જ ક્રિયા, ત્રણે વસ્તુસ્વરૂપ-અભિન્ન છે. ૫૧

અનેકરૂપ છે એક વસ્તુ, એકનું પરિણામ છે,  
 છે પરિણતિ બસ એકની ને એક પરિણામ થાય છે. ૫૨

ના પરિણામે જે એક થઈને, જેનું કો પરિણામ ના,  
 ના પરિણાતિ પણ એક થાયે, એક થાય અનેક ના. ૫૩

કર્તા નહીં બે એકનાં, બે કર્મ પણ નહીં એકનાં,  
નહીં બે ક્રિયાઓ એકની, કદી એક થાય અનેક ના. ૫૪

(હરિગીત)

‘પરને કહું હું’ - એ અહં અતિ કષ્ટથી નિર્વાર્ય છે,  
અનાદિથી જ અખંડ છે, આ જગતના સૌ મોહીને;  
ભૂતાર્થનયના ગ્રહણથી જો વિલય પામે તે અહો !  
તો જ્ઞાનના ઘનપિંડ આતમને કદી ના બંધ હો. ૫૫

(દોહરા)

પરભાવોને પર કરે, આત્મા આતમભાવ;  
આતમભાવ તે આતમ છે, પરના છે પરભાવ. ૫૬

ધાસસહિત મિષ્ટ<sup>જ્ઞ</sup> આરોગે ગજરાજ,  
સ્વાદ-ભેદ સમજે નહીં, માને મીઠું ઘાસ;  
જ્ઞાનસ્વરૂપ જે નિશ્ચયે એવો આતમરામ,  
આસ્વાદે છે રાગને નિજરૂપ માની આમ;  
દહીં-સાકર<sup>જ્ઞ</sup> સ્વાદનો લોલુપ જીવ અબૂ<sup>દ્</sup>ર્ષ,  
શિખંડ પીને માનતો પીવું છું ગૌ-દૂધ. ૫૭

(હરિગીત)

અજ્ઞાનથી જ્યમ દોડતાં મૃગ રેતને જળ જાણીને,  
જન પામતાં ભય અંધકારે દોરી વિષધર માનીને;

છે જ્ઞાનમય આ જીવ પણ અજ્ઞાનના કારણ થકી,  
આકુલિત થઈ કર્તા બને જ્યમ ક્ષુબ્ધ સાગર પવનથી. ૫૮

જ્યમ હંસ જાણે જ્ઞાનથી બસ નીર કીર વિશેષને,  
ત્યમ જીવ જે જાણે વિવેકે આપ પરના ભેદને;  
ચૈતન્યઘાતુ અચળમાં આરૂઢ થઈને તે સદા,  
બસ માત્ર જાણે પણ બને કિંચિત્ નહીં કર્તા કદા. ૫૯

(મંદકાંતા)

જ્ઞાની જાણે ગરમ જળમાં શીત-ઉષ્ણ વ્યવસ્થા,  
જ્ઞાની જાણે નમક રસને વ્યંજનોમાં વિવેકે;  
ક્રોધાદિને નિજરસ વડે પૂર્ણ ચૈતન્યઘાતુ,  
જ્ઞાની ભેદે વિલય કરતાં ભાવ કર્તૃત્વકેરો. ૬૦

(હરિગીત)

નિજને કરે અજ્ઞાનમય વા જ્ઞાનમય આ આત્મા,  
કર્તા બને નિજ ભાવનો, પરનો નહીં કર્તા કદા; ૬૧

આત્મા સ્વયં છે જ્ઞાન, જ્ઞાન વિના ખીજું તે શું કરે ?  
'પરભાવનો કર્તા બને' - વ્યવહારી જનનો મોહ છે. ૬૨

(દોહરા)

કરે ન પુદ્ગલકરમને જો આ ચૈતનરાજ,  
કોણ કરે - તે સૂણે હવે, ભરમ નિવારણ કાજ. ૬૩

(હરિગીત)

વ  
પુદ્ગલદરબીમાં સહજ નિજ સૌ પરિણમનની શક્તિ છે,  
ને વિદ્યન એના પરિણમનમાં કોઈપણ નથી આ રીતે;  
કર્તા ઠર્યું પુદ્ગલદરવ તેથી સ્વયંના ભાવનું,  
પુદ્ગલ તણા પરિણામનું આ કથન છે પરમાર્થનું. ૬૪

જીવદ્રવ્યમાં જ સ્વભાવભૂત સૌ પરિણમનની શક્તિ છે,  
ને વિદ્યન એના પરિણમનમાં કોઈ પણ નથી આ રીતે;  
કર્તા ઠર્યું જીવદ્રવ્ય તેથી જીવના પરિણામનું,  
જીવદ્રવ્ય કેરા પરિણામનું કથન આ પરમાર્થનું. ૬૫

(દ્વોહરા)

જ્ઞાનીના કયમ ભાવ બસ જ્ઞાનમય જ સૌ હોય ?  
વળી એના કો ભાવ કાં જ્ઞાન સહિત નહિ હોય ?  
અજ્ઞાનીના ભાવ સૌ અજ્ઞાનમય જ હોય,  
વળી એના કો ભાવ કાં જ્ઞાનસહિત નહિ હોય ? ૬૬

(હરિગીત)

અજ્ઞાનીના સૌ ભાવ તો અજ્ઞાનમાંથી જ નીપજે,  
ને જ્ઞાનીના સૌ ભાવ તો સદ્જ્ઞાનમાંથી જ નીપજે. ૬૭

(દ્વોહરા)

અજ્ઞાની અજ્ઞાનમય ભાવભૂમિમાં વ્યાપ્ત,  
આ કારણ દ્રવ્યબંધના હેતુપણાને પ્રાપ્ત. ૬૮

(હરિગીત)

નયપક્ષપાત તજ અને જે સ્વરૂપગુપ્ત બની રહે,  
થઈ શાંતચિત્ત વિકલ્પહીન તે આત્મઅમૃતને પીવે. ૬૯

(દોહરા)

એક કહે છે બદ્ધ ને બદ્ધ ન બીજો પક્ષ  
પક્ષો છે આ જીવ વિષે ઉભયનયોને લક્ષ;  
પક્ષપાતથી રહિત જન તત્ત્વવેદી જે થાય,  
ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ તેને સદા જણાય. ૭૦

એક કહે છે મૂઢને મૂઢ ન બીજો પક્ષ  
પક્ષો છે આ જીવ વિષે ઉભયનયોને લક્ષ;  
પક્ષપાતથી રહિત જન તત્ત્વવેદી જે થાય  
ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ તેને સદા જણાય. ૭૧

એક કહે છે રક્ત ને રક્ત <sup>ન</sup> બીજો પક્ષ,  
પક્ષો છે આ જીવ વિષે ઉભયનયોને લક્ષ;  
પક્ષપાતથી રહિત જન તત્ત્વવેદી જે થાય,  
ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ તેને સદા જણાય. ૭૨

દ્વેષી છે દ્વેષી નથી એવા છે બે પક્ષ,  
પક્ષો છે આ જીવ વિષે ઉભયનયોને લક્ષ;  
પક્ષપાતથી રહિત જન તત્ત્વવેદી જે થાય,  
ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ તેને સદાય જણાય. ૭૩

૧૨૫

૧૨૫

કર્તા છે કર્તા નથી એવા છે બે પક્ષ,  
પક્ષો છે આ જીવ વિષે ઉભયનયોને લક્ષ;  
પક્ષપાતથી રહિત જન તત્વવેદી જે થાય,  
ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ તેને સદા જણાય. ૭૪

ભોક્તા છે ભોક્તા નથી એવા છે બે પક્ષ,  
પક્ષો છે આ જીવ વિષે ઉભયનયોને લક્ષ;  
પક્ષપાતથી રહિત જન તત્વવેદી જે થાય,  
ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ તેને સદા જણાય. ૭૫

એક કહે છે જીવ ને જીવ ન બીજો પક્ષ,  
પક્ષો છે આ જીવ વિષે ઉભયનયોને લક્ષ;  
પક્ષપાતથી રહિત જન તત્વવેદી જે થાય,  
ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ તેને સદા જણાય. ૭૬

એક કહે છે સૂક્ષ્મને સુક્ષ્મ ન બીજો પક્ષ,  
પક્ષો છે આ જીવ વિષે ઉભયનયોને લક્ષ;  
પક્ષપાતથી રહિત જન તત્વવેદી જે થાય,  
ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ તેને સદા જણાય. ૭૭

એક કહે છે હેતુ ને હેતુ ન બીજો પક્ષ,  
પક્ષો છે આ જીવ વિષે ઉભયનયોને લક્ષ;  
પક્ષપાતથી રહિત જન તત્વવેદી જે થાય,  
ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ તેને સદા જણાય. ૭૮

તત્વ



એક કહે છે કાર્ય ને કાર્ય ન બીજો પક્ષ,  
પક્ષો છે આ જીવ વિષે ઉભયનયોને લક્ષ;  
પક્ષપાતથી રહિત જન તત્ત્વવેદી જે થાય,  
ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ તેને સદા જણાય. ૭૯

એક કહે છે ભાવ ને ભાવ ન બીજો પક્ષ,  
પક્ષો છે આ જીવ વિષે ઉભયનયોને લક્ષ;  
પક્ષપાતથી રહિત જન તત્ત્વવેદી જે થાય,  
ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ તેને સદા જણાય. ૮૦

એક કહે છે એક ને એક ન બીજો પક્ષ,  
પક્ષો છે આ જીવ વિષે ઉભયનયોને લક્ષ;  
પક્ષપાતથી રહિત જન તત્ત્વવેદી જે થાય,  
ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ તેને સદા જણાય. ૮૧

એક કહે છે સાંત ને સાંત ન બીજો પક્ષ,  
પક્ષો છે આ જીવ વિષે ઉભયનયોને લક્ષ;  
પક્ષપાતથી રહિત જન તત્ત્વવેદી જે થાય,  
ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ તેને સદા જણાય. ૮૨

એક કહે છે નિત્ય ને નિત્ય ન બીજો પક્ષ,  
પક્ષો છે આ જીવ વિષે ઉભયનયોને લક્ષ;  
પક્ષપાતથી રહિત જન તત્ત્વવેદી જે થાય,  
ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ તેને સદા જણાય. ૮૩

એક કહે છે વાચ્ય ને વાચ્ય ન બીજો પક્ષ,  
પક્ષો છે આ જીવ વિષે ઉભયનયોને લક્ષ;  
પક્ષપાતથી રહિત જન તત્ત્વવેદી જે થાય,  
ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ તેને સદા જણાય. ૮૪

નાના છે નાના નથી એવા છે બે પક્ષ,  
પક્ષો છે આ જીવ વિષે ઉભયનયોને લક્ષ;  
પક્ષપાતથી રહિત જન તત્ત્વવેદી જે થાય,  
ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ તેને સદા જણાય. ૮૫

એક કહે છે ચેત્ય ને ચેત્ય ન બીજો પક્ષ,  
પક્ષો છે આ જીવ વિષે ઉભયનયોને લક્ષ;  
પક્ષપાતથી રહિત જન તત્ત્વવેદી જે થાય.  
ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ તેને સદા જણાય. ૮૬  
તત્ત્વ

એક કહે છે દશ્ય ને દશ્ય ન બીજો પક્ષ,  
પક્ષો છે આ જીવ વિષે ઉભયનયોને લક્ષ;  
પક્ષપાતથી રહિત જન તત્ત્વવેદી જે થાય,  
ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ તેને સદા જણાય. ૮૭  
તત્ત્વ

એક કહે છે વેદ્ય ને વેદ્ય ન બીજો પક્ષ,  
પક્ષો છે આ જીવ વિષે ઉભયનયોને લક્ષ;

પક્ષપાતથી રહિત જન તત્ત્વવેદી જે થાય,  
ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ તેને સદા જણાય. ૮૮

એક કહે છે કે ભાત ને ભાત ન બીજો પક્ષ,  
પક્ષો છે આ જીવ વિષે ઉભયનયોને લક્ષ;  
પક્ષપાતથી રહિત જન તત્ત્વવેદી જે થાય,  
ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ તેને સદા જણાય. ૮૯

(હરિગીત)

જેમાં ઉઠે છે જાળ આમ વિકલ્પ તણી બહુવિધની,  
ઓળંગી જઈને ભૂમિને બહુ મોટી એ નયપક્ષની;  
જીવ તત્ત્વવેદી પામતો અનુભૂતિમાત્ર સ્વભાવને,  
સમતારૂપી રસ જેહનો છે ભાવ અંતર બાહ્ય ને. ૯૦

(દોહરા)

ચંચળ, વિપુલ, મહાન છે વિકલ્પરૂપ તરંગ,  
એનાથી બનતી બધી ઈન્દ્રજાળ અનંત;  
તત્કાણામાં સહુ તેહ બસ વિલયપ્રાપ્ત થઈ જાય,  
જેના સ્ફુરણથી છું હું તે ચિત્પુંજ સદાય. ૯૧

ભવાય છે ચિત્પુંજથી ભાવાભાવ ને ભાવ,  
એવું છે પરમાર્થરૂપ, તેથી એક સ્વભાવ;  
કર્મજનિત સહુ પદ્ધતિ, બંધની કરી હું પાર,  
અનુભવું છું માત્ર એ સમયસાર અપાર. ૯૨

(હરિગીત)

પુરાણ પુસ્તક પવિત્ર જે વિજ્ઞાનઘન ભગવાન છે,  
આસ્વાદ્ય નિભૂતજન થકી બસ તે જ દર્શન જ્ઞાન છે;  
નયપક્ષવણ અવિકલ્પ અવિચલ એ સમયનો સાર છે,  
કહીએ વધું શું, હો બધું, પણ એ જ સૌનો સાર છે. ૯૩

નિજ સમૂહથી ચ્યૂત પાણી જે ભમતું કહી કો વન વિષે,  
તો ઢાળથી તે વાળતાં પાછું જ મળતું સમૂહને;  
નિજ ભાવથી ચ્યૂત આત્મા ભમતો વિકલ્પવને ઘણાં,  
વિવેકઢાળથી તેહને નિજ વીર્યપૂર્વક વાળતાં;  
વિજ્ઞાનઘન નિજ સ્વરૂપમાં ખેંચાઈ આવે આત્મા,  
વિજ્ઞાનઘનના રસિક જન જે અનુભવે છે આત્મા. ૯૪

(દોહરા)

વિકલ્પનો કરનાર તે કેવળ કર્તા હોય,  
વિકલ્પ તેનું જ કર્મ બસ, અન્ય કંઈ નવ હોય,  
જ્યાં લગી કોઈ આત્મા, રહિતવિકલ્પ ન હોય,  
કર્તાકર્મપણા તણો નાશ કદાપિ ન હોય. ૯૫

(ચોપાઈ)

કરે કરમ છે તે કરનાર,  
જે જાણે તે જાણનાહાર;  
કરનારો નહિ જાણનાહાર,  
જાણનાહાર નહીં કરનાર. ૯૬

| ૧૨૦૨.

(સવૈયા એકત્રીસા)

કરવારૂપ ક્રિયાની અંદર જાણનકિરિયાનો નહિ ભાસ,  
જાણનરૂપ ક્રિયાની અંદર કરતાકિરિયાનો નહિ વાસ;  
ભિન્ન ભિન્ન તેથી છે બન્ને શક્તિ તેમ કરોતિ જાણ,  
વળી કર્યું એથી પણ એવું, જ્ઞાતા તે કર્તા નહિ માન. ૯૭

(હરિગીત)

નથી કર્મમાં કર્તા અને વળી કર્મ કર્તામાં નથી,  
તેથી જ કર્તાકર્મની સ્થિતિ કદી બનતી નથી;  
છે કર્મમાં બસ કર્મ, જ્ઞાતા જ્ઞાનમાં જ રહે ખરે,  
છે આમ તોયે મોહ ~~સૌ~~ આ કાં નાયતો રહેતો અરે ! ૯૮

પ્રગટી પ્રબળ આ જ્ઞાનજ્યોતિ અચળ વ્યક્ત અહો વળી,  
ગંભીર જે સૌ ચિત્સ્વરૂપ નિજ શક્તિઓના ભારથી;  
કર્તા ન થાયે આતમા, પુદ્ગલ કરમરૂપ થાય ના,  
પુદ્ગલ રહે પુદ્ગલ મહીં ને જ્ઞાન પણ નિજ સ્વરૂપમાં. ૯૯



# ପୁରାଣ-ପାଠ ଅଭିଧାନ

(ଫରିଦାବାଦ)

ଶୁଣ ନି ଭାଷଣରା ମାତ୍ର ଯେ ତୁ-ପାଠରା ପାଠକ,  
ତା ଫଳପାଠ ଯେଣୁ ହେଉ ଅଧିକାରୀ ହିରା;  
ତୁମେ ଫଳ ତା ମାତ୍ରରା ଅମଳ ଅମଳ ଯେଣୁ ଅଧିକାରୀ!  
ମାତ୍ର ଅଧିକାରୀ ତା ହେଉ ନି ଅଧିକାରୀ ନି ପାଠକ। ୧୦୦.

(ଫାତେରୀ)

ଶୁଣାଗଲି ପୁଅ ତା ଯେଣୁ ଅଧିକାରୀ ତା,  
ତା ହେଉ ନି ଅଧିକାରୀ ତା ତା ଯେଣୁ ତା ଯେଣୁ;  
'ଶୁଣ ତୁ' - ମାତ୍ର ମାତ୍ର, ତା ମାତ୍ର-ଅଧିକାରୀ,  
ତା ମାତ୍ର ଅଧିକାରୀ ମାତ୍ର ନି 'ଶୁଣ ତା' - ଅଧିକାରୀ;  
ଶୁଣାଗଲି ହେଉ ଯେଣୁ ତା ଅଧିକାରୀ,  
ମାତ୍ର ଅଧିକାରୀ ନି ଅଧିକାରୀ ଅଧିକାରୀ;  
ତା ମାତ୍ର ଅଧିକାରୀ ତା ଅଧିକାରୀ ଅଧିକାରୀ,  
ପୁରାଣ-ପାଠ ତା ତା ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ। ୧୦୧.

(ଫରିଦାବାଦ)

ଶୁଣ, ଅଧିକାରୀ ଅଧିକାରୀ ନି ଅଧିକାରୀ ମାତ୍ର ଅଧିକାରୀ,  
ତା ଅଧିକାରୀ ତା ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ;  
ନି ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ,  
ନି ଅଧିକାରୀ ଅଧିକାରୀ ତା ଅଧିକାରୀ ଅଧିକାରୀ। ୧୦୨.

ତା ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ,  
ନି ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ। ୧୦୩.

ଶୁଣ ନି ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ,  
ନି ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ;  
ତା ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ,  
ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ। ୧୦୪.

ଶୁଣ ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ,  
ତା ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ;  
ତା ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ,  
ତା ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ ଅଧିକାରୀ। ୧୦୫.

(10821)

ಶಾಗೃಹದ ಪರಿಶೋಧನೆ ಶಾಗೃಹದ ಪರಿಶೋಧನೆ  
ಮತ್ತು ಇತರ ವಿಷಯಗಳಿಗೆ ಈ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ  
~~ಮಾಹಿತಿ~~ ~~ಮಾಹಿತಿ~~ ~~ಮಾಹಿತಿ~~ ~~ಮಾಹಿತಿ~~ ~~ಮಾಹಿತಿ~~ ~~ಮಾಹಿತಿ~~ ~~ಮಾಹಿತಿ~~  
ಸಾಮಾನ್ಯ ಪರಿಶೋಧನೆ ಶಾಗೃಹದ ಪರಿಶೋಧನೆ  
ಮತ್ತು ಇತರ ವಿಷಯಗಳಿಗೆ ಈ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ  
ಮಾಹಿತಿ  
909.

ಈ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ವಿವರಿಸಿದಂತೆ 1202  
ರೂಪಾಯಿಗಳಿಗೆ ಈ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ  
908.

(10822)

ಶಾಗೃಹದ ಪರಿಶೋಧನೆ ಮತ್ತು ಇತರ ವಿಷಯಗಳಿಗೆ  
ಈ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಮಾಹಿತಿ  
ಮತ್ತು ಇತರ ವಿಷಯಗಳಿಗೆ ಈ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ  
ಮಾಹಿತಿ  
907.

ಮಾಹಿತಿ ಮತ್ತು ಇತರ ವಿಷಯಗಳಿಗೆ  
ಈ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಮಾಹಿತಿ  
ಮತ್ತು ಇತರ ವಿಷಯಗಳಿಗೆ ಈ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ  
ಮಾಹಿತಿ  
906.

ಮಾಹಿತಿ ಮತ್ತು ಇತರ ವಿಷಯಗಳಿಗೆ  
ಈ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಮಾಹಿತಿ  
ಮತ್ತು ಇತರ ವಿಷಯಗಳಿಗೆ ಈ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ  
ಮಾಹಿತಿ  
999.

ಮಾಹಿತಿ ಮತ್ತು ಇತರ ವಿಷಯಗಳಿಗೆ  
ಈ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಮಾಹಿತಿ  
ಮತ್ತು ಇತರ ವಿಷಯಗಳಿಗೆ ಈ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ  
ಮಾಹಿತಿ  
912.

આવૃત્તિ આધાર (જુન ૧૧૩ ને ૧૨૨)

જુન ૧૧૩

(હિસાબ)

આવૃત્તિ આધાર (જુન ૧૧૩) ની મુજબ આવૃત્તિમાં છે,

સાથે જ ભાગ છે આધાર દિવસે અને છે;

જેમ કે આધાર આધાર જેમ દુર્લભ જાણી,

ગાંધી છે, આજે તો છે પતી જેમ આધાર જાણી. ૧૧૩.

આ જેમ જાણી જાણી! ૧૧૩.

૦૨

(હિંદી પદ્યોમાં પરક)

(હિસાબ)

આવૃત્તિ જાણ જાણી રહ્યાં જેમ આધારમાં આ,

આધાર (જુન ૧૧૩) આધાર મુજબ આ છે માત્ર આ;

મુજબ જે આધાર આધાર આધાર જે જાણી.

જે આધાર ને ગાંધી છે, આધાર આધાર આધાર. ૧૧૩.

જુન ૧૧૨

(હિસાબ)

આ આધાર આધાર જે આધાર માત્ર છે,

જે આધાર-આધાર-આધાર આધાર આધાર આધાર આધાર;

આધાર આધાર આધાર જે આધાર આધાર આધાર છે,

ને આધાર આધાર આધાર આધાર આધાર આધાર. ૧૧૨

આવૃત્તિ આધાર  
આધાર આધાર આધાર  
આધાર આધાર આધાર



૧૫૧૧૧૫

(દોષ)

સુભાષીને ભાગ જે સુભાષી સુભાષી,  
 ભાષાભાષી જે બધી ભાષાને પામે;  
 તેલ પુત્રે આ રીતે વિચારવા જે દિય,  
 તેને જાણ્યું ભાષાને જાણ્યું નહીં જે દિય. ૧૧૫

OR

(દોષ)

સુભાષીને ભાગ જે સુભાષી સુભાષી,  
 ભાષાભાષી જે બધી ભાષાને પામે;  
 તેને જાણ્યું ભાષાને જાણ્યું નહીં જે દિય,

જેલ પુત્રે આ રીતે વિચારવા જે દિય. ૧૧૫.  
 જાણી ભાષાને આ રીતે વિચારવા જે દિય. ૧૧૬.

૧૫૧૧૧૫ :

(દોષ)

જાણે તેને જાણી જાણીને જાણી,  
 જુલુજુલુ રાજાને તેને જાણી પરિણામ;  
 બધી જાણીને વિચારવાને બાજુએ જાણી,  
 જોઈને તેને જાણી પાળી જુલુજુલુ રાજા;  
 જાણીને જાણીને જાણીને જાણીને,  
 જાણીને જાણીને જાણીને જાણીને ૧૧૬.

୧୫୫୭୭୭

(ଫିଲ୍ଡି)

ଫୁଲ୍‌ପାଲ୍‌ର ଡାକ୍ତରୀ ଲେଖନୀ କି ହେଉଛି,

କାହାଣୀ କି ଡାକ୍ତରୀ ଲେଖନୀ ଲେଖନୀ କି ହେଉଛି ?

ଫୁଲ-୧୧୫  
(ଫୁଲଗ)


କୋରୁଣା ସଂ ଶକ୍ତି ଓ ସର ସର କୋରୁଣା ଓ,  
ମା ଓ ପୁଅ ପୁଅ କାହାଣୀ ଏହି କୋରୁଣା କୋରୁଣା;  
ମା ଓ କୋରୁଣା କୋରୁଣା ଓ ମା ଓ କୋରୁଣା,  
କୋରୁଣା କୋରୁଣା କୋରୁଣା କୋରୁଣା କୋରୁଣା ୧୧୫.

ଫୁଲ ୧୧୬  
~~ଫୁଲ ୧୧୫~~ (ଫୁଲଗ)

କୋରୁଣା କୋରୁଣା କୋରୁଣା କୋରୁଣା;  
କୋରୁଣା କୋରୁଣା କୋରୁଣା କୋରୁଣା ୧୧୬.

ଫୁଲ ୧୧୭  
(ଫୁଲଗ)

କୋରୁଣା କୋରୁଣା କୋରୁଣା କୋରୁଣା କୋରୁଣା,  
ଫୁଲ ଓ କୋରୁଣା କୋରୁଣା କୋରୁଣା କୋରୁଣା;  
ଫୁଲ ଓ କୋରୁଣା କୋରୁଣା କୋରୁଣା କୋରୁଣା;  
ଫୁଲ ଓ କୋରୁଣା କୋରୁଣା କୋରୁଣା କୋରୁଣା;  
ଫୁଲ ଓ କୋରୁଣା କୋରୁଣା କୋରୁଣା କୋରୁଣା ୧୧୭.



ପୂର୍ଣ୍ଣ 921

(ପ୍ରଶ୍ନାବଳୀ)

କେଉଁ ପ୍ରକାରର ସ୍ତମ୍ଭ ଦିଏ ଓ ସେହି ସ୍ତମ୍ଭର ନାମ କ'ଣ? ଓ,  
 \* ଓ ଯୋଗ୍ୟତା ସମ୍ପର୍କ ଦର୍ଶାଏ।  
 \* ଓ ଯୋଗ୍ୟତା ସମ୍ପର୍କ ଦର୍ଶାଏ।  
 \* ଓ ଯୋଗ୍ୟତା ସମ୍ପର୍କ ଦର୍ଶାଏ।

ଏ ପ୍ରକାରର ସ୍ତମ୍ଭର ନାମ କ'ଣ?

ଏ ପ୍ରକାରର ସ୍ତମ୍ଭର ନାମ କ'ଣ? 921.

ପୂର୍ଣ୍ଣ 922

(ପ୍ରଶ୍ନାବଳୀ)

ନିମ୍ନ ଉଲ୍ଲେଖିତ ସ୍ତମ୍ଭର ନାମ କ'ଣ? ଓ ପ୍ରକାର ଦର୍ଶାଏ।

ଏ ପ୍ରକାରର ସ୍ତମ୍ଭର ନାମ କ'ଣ? 922.

ପୂର୍ଣ୍ଣ 923

(ପ୍ରଶ୍ନାବଳୀ)

କେଉଁ ପ୍ରକାରର ସ୍ତମ୍ଭର ନାମ କ'ଣ? ଓ ପ୍ରକାର ଦର୍ଶାଏ।

ଏ ପ୍ରକାରର ସ୍ତମ୍ଭର ନାମ କ'ଣ? ଓ ପ୍ରକାର ଦର୍ଶାଏ।

କେଉଁ ପ୍ରକାରର ସ୍ତମ୍ଭର ନାମ କ'ଣ? ଓ ପ୍ରକାର ଦର୍ଶାଏ।

ଏ ପ୍ରକାରର ସ୍ତମ୍ଭର ନାମ କ'ଣ? 923.

૧૯૧૧ ૧૨૨

(૧૨૨૦૦૦)

કૃષિને જેને જાણ એવું મર્યાદાથી દૂર,

જે સર્વ સીને જાણ એના આચાર્ય કાલ મળે;

જે આચાર્ય તેને આજુબાજુ તોલ તેજુ મર્યાદા,

જાણના નથી કૃષિને જે સર્વ જાણ મળે. ૧૨૨.

2102 અલેકઝાંદર (1924 & 932) [2102-9

1924

(As finalized on 8/25/99)

(સંસ્કૃત)

અભાષણી ટીકાઓના નવમી અધ્યાયનામાં

વિવેચન ફરી, વિચાર અને સંકટ ની વિષય

ફરી થઈ, આ ગાથાઓના ભાગ (અર્થ નો અર્થ)

મુદત જુદી, વિચાર અર્થ! અભ્યાસ વિવેચનમાં. 124.

1929

(સંસ્કૃત)

આ ગાથા એ વિવેચન વિષય ટીકા નો અર્થ છે,

ફરી જે અભ્યાસ વિવેચન નો અર્થ આ ગાથા,

આ વિષયના વિષય છે અર્થનો અર્થ,

~~અભ્યાસ~~ અર્થ નો અભ્યાસ અર્થનો અર્થ. 125.  
અભ્યાસ અર્થ નો અભ્યાસ! અભ્યાસ વિષય અર્થ. 125

1929

(સંસ્કૃત)

સંસ્કૃત

વિષયના અભ્યાસ ફરી અભ્યાસ અર્થ,

અભ્યાસ વિવેચન નો અર્થ વિવેચન;

અર્થ અર્થ અર્થ છે, અર્થ અર્થ અર્થ,

અભ્યાસના અર્થ નો અર્થ અર્થ અર્થ. 125.



မှတ်ချက် ၄၃၂

ငါ့အတွက်

အားလုံးက အားပေးပေး အားပေးပေးပါ။

အားပေးပေးပါ။ နားထောင်ပါ။ အားပေးပေးပါ။

အားပေးပေးပါ။ အားပေးပေးပါ။ အားပေးပေးပါ။

အားပေးပေးပါ။ အားပေးပေးပါ။ အားပေးပေးပါ။

အားပေးပေးပါ။ အားပေးပေးပါ။ အားပေးပေးပါ။

✓ နားထောင်ပါ။ အားပေးပေးပါ။ အားပေးပေးပါ။ ၄၃၂။

---

၄. အားပေးပေးပါ။ အားပေးပေးပါ။ အားပေးပေးပါ။ အားပေးပေးပါ။ အားပေးပေးပါ။ (အားပေးပေးပါ။ ၄၃၂။)



ਨਿਰੰਤਰ ਅਨੁਭਵ (finalized) (ਨਿਰੰਤਰ - ੧  
(ਜੁਲਾਈ ੧੩੩੩ ਤੋਂ ੧੯੨੨) As of ੭/੭/੧੯੧੯)

ਜੁਲਾਈ ੧੩੩੩

(ਫਿਰੋਜ਼ਪੁਰ)

ਤਿਆਗੇ ਅਨੁਭਵ ਕੀਤੇ ਨਿਰੰਤਰ ਅਨੁਭਵੀ ਆਗੂ,

ਅਨੁਭਵੀ ਅਨੁਭਵੀ ਆਗੂ ਅਤੇ ਅਨੁਭਵੀ ਆਗੂ;

ਜਿਹੜੇ ਅਨੁਭਵ ਨਿਰੰਤਰ ਅਨੁਭਵੀ ਆਗੂ,

ਜਿਹੜੇ ਅਨੁਭਵੀ ਅਨੁਭਵੀ ਅਨੁਭਵੀ ਆਗੂ ੧੩੩੩.

ਜੁਲਾਈ ੧੩੩੪

ਜਿਹੜੇ ਅਨੁਭਵੀ ਅਨੁਭਵੀ ਅਨੁਭਵੀ ਆਗੂ,

ਅਨੁਭਵੀ ਅਨੁਭਵੀ ਅਨੁਭਵੀ ਆਗੂ ੧੩੩੪.

ਜੁਲਾਈ ੧੩੩੫

(ਫਿਰੋਜ਼ਪੁਰ)

ਅਨੁਭਵੀ ਅਨੁਭਵੀ ਅਨੁਭਵੀ ਆਗੂ,

ਅਨੁਭਵੀ ਅਨੁਭਵੀ ਅਨੁਭਵੀ ਆਗੂ;

ਜਿਹੜੇ ਅਨੁਭਵੀ ਅਨੁਭਵੀ ਅਨੁਭਵੀ ਆਗੂ,

ਅਨੁਭਵੀ ਅਨੁਭਵੀ ਅਨੁਭਵੀ ਆਗੂ ੧੩੩੫.

ਜੁਲਾਈ ੧੩੩੬

(ਫਿਰੋਜ਼ਪੁਰ)

ਅਨੁਭਵੀ ਅਨੁਭਵੀ ਅਨੁਭਵੀ ਆਗੂ,

ਅਨੁਭਵੀ ਅਨੁਭਵੀ ਅਨੁਭਵੀ ਆਗੂ;

ਅਨੁਭਵੀ ਅਨੁਭਵੀ ਅਨੁਭਵੀ ਆਗੂ,

ਅਨੁਭਵੀ ਅਨੁਭਵੀ ਅਨੁਭਵੀ ਆਗੂ ੧੩੩੬.

1691 939

(1693/1694)

હું હું સુખ સુખ સુખને લઈ શકું નાં તરી,

જે સુખ માની સુખ સુખને ગાઈ શકું તરી;

સુખને માત્રે પ્રાપ્ત કરીને માત્રે ને માત્રે માત્રે,

માત્રે માત્રે લઈને સુખને ગાઈ શકું તરી! 939.

1691 935

જે સુખ માત્રે સુખને માત્રે માત્રે પ્રાપ્ત કરી,

ને સુખ માત્રે, ને સુખ માત્રે સુખને માત્રે કરી;

માત્રે માત્રે માત્રે માત્રે પ્રાપ્ત કરી છે, માત્રે છે,

સુખને માત્રે સુખને માત્રે પ્રાપ્ત કરી છે. 935.

1691 936

જે સુખ પ્રાપ્ત કરીને માત્રે ને માત્રે પ્રાપ્ત કરી છે;

જે સુખ પ્રાપ્ત કરીને માત્રે ને માત્રે પ્રાપ્ત કરી છે. 936.

1691 930

જે સુખ પ્રાપ્ત કરીને માત્રે પ્રાપ્ત કરી,

જે સુખ પ્રાપ્ત કરીને માત્રે પ્રાપ્ત કરી;

જે સુખ પ્રાપ્ત કરીને માત્રે પ્રાપ્ત કરી,

ને સુખ પ્રાપ્ત કરીને માત્રે પ્રાપ્ત કરી. 930.

1991-979

(1991-979)

ਮੀਨੇ ਤਿਰਲਾ ਪਵਿਠੀ 27 ਸਾਲ ਚੰਦੁ ਸਮੇਂ ਚਲ,

ਫੀਠੇ ਚੰਦੁ ਤੰਦੇਵਾਕੇ ਕੋਲੀ ਕਾ ਨਿਰਿਖ ਚਲੀ;

ਮਹਾਮਾਨ ਨੇ ਕੰਫਲੁਗਿਠਿ ਏ ਖੋਗਲਾਗਾਰ ਮਠਾ,

ਏ ਕੀਤ ਪਰਿ ਸੀਨੇ ਕੀਨੇ ਨੜੰਗੜੀ ਕੇ ਕੀਤਾ! 979.

1991-982

ਫਿਠ ਮਾਠੇ ਫੀਠੀ ਪਾਨੇ ਚੁਪਏ ਕੀਨੇ ਫੀਠੀ ਚੀ,

ਕੇ ਫਿਠ ਪਾਨੇ ਫੀਠੀ ਚਿਰਕੁਤਫਿਨ ਧੁਨ ਕੀਠੇ ਚੀ;

ਪਰਿ ਨਿਰਾਖ ਤੰਦੇਵੀਮਾਨ ਚੰਦੁ ਕੀਠੇ ਚੇ ਪਏ ਕੀਠੇ,

ਨੇ ਚਾਨੀ ਕੀਠੀ ਪੁਠਿ ਨੇ ਚਾਨੜੀਠੀ ਫਿਰਾ ਪਾਠੇ. 982.

1991-983

ਕੀ ਚਾਨੜੀ ਪਏ ਪੜੇਪੜ ਫੀਠੀ ਚੁਠਿਠ ਏ,

ਨੇ ਪੁਠਿ ਕੀਠੀ ਚੀਠ ਚਾਨੜੀ ਚੀ ਕੀਨੇ ਚੁਠਿਠ ਏ;

ਕੀ ਚਾਨੜੀਠੀ ਪਾਨੀ ਚਿਰ ਚਾਨੜੀਠੀ ਫੀਠੀ ਚੀ,

ਨੇ ਫੀਠੀ ਕੀਠੀ ਚਿਰਕੁਤਫਿਨ, ਚਾਨੜੀ ਚੰਦੁ ਚੰਦੁ ਨੇ. 983.

1991-984

(1991-984)

ਕੀਠੀਠੀ ਚਾਨੜੀ ਚਿਰਿ ਏ ਚਾਨੀ ਕੀਨੇ ਚੀਠ,

ਨੇ ਚਾਨੜੀ ਚਿਰਕੁਤਫਿਨ ਚਾਨੀਠੇ ਚ ਫੀਠੇ;

ਨੇ ਚੰਦੁ ਪੁਠੀਠੀ ਕੀਨੀ ਚਿਰਿ ਚ ਚੀਠ,

ਕੀਨੀ ਪੜੇਪੜੀਠੀ ਫੀਠੀ ਚਾਨੜੀ ਚ ਨੇ ਚੀਠ. 984.

ଫୁଲ ୧୩:

(ଫିଲୋମ)

କାମିନୀ ଥା-ପୂର୍ବ ଉପାଧିକାରୀଙ୍କ ଉପାଧିକାର ଓ ଅଧିକାରୀ,

ଓ କିମ୍ବା ଉପାଧିକାରୀ ଉପାଧିକାରୀଙ୍କ ଉପାଧିକାରୀ;

ଫିଲୋମ ପରିଷଦ ଉପାଧିକାରୀଙ୍କ ଉପାଧିକାରୀ,

ଓ ଉପାଧିକାରୀଙ୍କ ପରିଷଦ ଉପାଧିକାରୀଙ୍କ ଉପାଧିକାରୀ. ୧୩.

ଫୁଲ ୧୪

କିମ୍ବା ଉପାଧିକାରୀଙ୍କ ଉପାଧିକାରୀଙ୍କ ଉପାଧିକାରୀ;

ପରିଷଦ ଉପାଧିକାରୀଙ୍କ ଉପାଧିକାରୀଙ୍କ ଉପାଧିକାରୀ. ୧୪.

ଫୁଲ ୧୫

(ଫିଲୋମ)

କିମ୍ବା ଉପାଧିକାରୀଙ୍କ ଉପାଧିକାରୀଙ୍କ ଉପାଧିକାରୀ,

ଫିଲୋମ ଉପାଧିକାରୀଙ୍କ ଉପାଧିକାରୀଙ୍କ ଉପାଧିକାରୀ;

ଫିଲୋମ ଉପାଧିକାରୀଙ୍କ ଉପାଧିକାରୀଙ୍କ ଉପାଧିକାରୀ,

ଫିଲୋମ ଉପାଧିକାରୀଙ୍କ ଉପାଧିକାରୀଙ୍କ ଉପାଧିକାରୀ. ୧୫.

ଫୁଲ ୧୬

(ଫିଲୋମ)

କିମ୍ବା ଉପାଧିକାରୀଙ୍କ ଉପାଧିକାରୀଙ୍କ ଉପାଧିକାରୀ,

ଫିଲୋମ ଉପାଧିକାରୀଙ୍କ ଉପାଧିକାରୀଙ୍କ ଉପାଧିକାରୀ;

କିମ୍ବା ଉପାଧିକାରୀଙ୍କ ଉପାଧିକାରୀଙ୍କ ଉପାଧିକାରୀ,

ପରିଷଦ ଉପାଧିକାରୀଙ୍କ ଉପାଧିକାରୀଙ୍କ ଉପାଧିକାରୀ. ୧୬.

1091 945

(86200)

102222 2A 2101 240100 21010001 812 0;

2E 1010 1020 001 001° 1020 11020 0. 945

1091 940

10201 012 102 240100 1021000 24010001,

012 2102 102 0120 11 1021000 10210001;

01 1021000 102 1021000, 21010000 00 001°,

01 1021000! 1021000 1021000, 1021000 012 00 001° 940.

1091 949

01 1021000! 012 102 1020° 1020 012 1020 001,

'1021000 102 1021000 012 1021000°' 1020 102001

01 102 012 102001, 102001 012 2102 0121000\* 012;

012 1021000 1020 012 012, 1020 2102 1020 012!

'1021000 102100000 012 012 - 1021000 102°'

01 2102 012 1020 102° - 012 1021000 0120 001?

012 1021000 1020 2102 0120 012 1020 1021000,

012° 012 00 01200 1020 1020 0121000 012. 949

\* 0121000 = 1021000 (-1021000) 012 1021000012 - 1021000012 (1021000012 - 1021000012)

fur, 943

(87000)

for ane zure n nise for Gumezi us,

Esai zisen for ze n hame zure me;

zura zure zure ze for yin fei zure sa,

ei zure zure zure, n for ze yin Gue sa. 942.

fur, 943

zure zure zure for ze - yin yin sa,

me zure zure zure yin for zure fei;

ni zure zure zure zure zure zure zure!

ni for zure zure n zure zure zure zure zure. 943.

fur, 944

zure zure zure zure zure zure zure,

yin zure zure zure zure zure zure zure;

zure zure zure zure zure zure zure sa,

Gue ei zure zure zure zure zure zure zure. 944.

1991 944

(197000)

2000 100000000 1000 1000 2000, 100000 10 2000  
 10 100000 1000 20 2000 1000000 10000;  
 2000000 1000 1000 20 1000000 10000,  
 200000 1000 100000 2000 10 100000 10000;  
 1000 1000 2000000, 1000000 1000 1000000,  
 10 10 10000 1000 100000 10000 10 1000000. 944.

1991 949

1000-1000000 1000 20000 20 10000,  
 10 1000 1000 10000, 10000 100000 100000;  
 1000 1000 1000 1000, 1000 1000000 1000000?  
 10 10 10000 1000 100000 10000 10 1000000. 949.

1991 949

1000 100000 1000 10 2000 1000 1000 1000 1000,  
 1000 10 2000 1000 1000 1000 1000 1000000;  
 1000 100000 1000 1000000 1000 1000 1000000,  
 10 10 10000 1000 100000 100000 10 1000000. 949.

1991 948

(1991 948)

1991 948 1991 948, 1991 948 1991 948,  
 1991 948 1991 948 1991 948, 1991 948 1991 948;  
 1991 948 1991 948 1991 948 1991 948,  
 1991 948 1991 948 1991 948 1991 948 1991 948.

1991 948

1991 948 1991 948 1991 948, 1991 948 1991 948,  
 1991 948 1991 948 1991 948 1991 948;  
 1991 948 1991 948 1991 948 1991 948,  
 1991 948 1991 948 1991 948 1991 948 1991 948.

1991 950

1991 950 1991 950, 1991 950, 1991 950, 1991 950,  
 1991 950 1991 950 1991 950, 1991 950 1991 950;  
 1991 950 1991 950 1991 950 1991 950,  
 1991 950 1991 950 1991 950 1991 950 1991 950.

1991 951

1991 951 1991 951 1991 951 1991 951,  
 1991 951 1991 951 1991 951 1991 951;  
 1991 951 1991 951 1991 951 1991 951,  
 1991 951 1991 951 1991 951 1991 951 1991 951.



୧୯୯୧ ୧୯୯୨

(କ୍ରମାଙ୍କ)

ଉପର ଉପର ଅଧ୍ୟାୟର ଉପର ଉପର ଉପର ଉପର  
 ଉପର ଉପର ଉପର ଉପର ଉପର ଉପର ଉପର;  
 ଉପର ଉପର ଉପର-ଉପର-ଉପର ଉପର ଉପର ଉପର,  
 ଉପର ଉପର ଉପର ଉପର ଉପର ଉପର ଉପର ଉପର. ୧୯୯୨.

ଶିକ୍ଷା ଉପର ଉପର

ગોંધા ઢાંચા  
(પુસ્તક ૧૬૩ ની ૧૨૮)

Revised [ગોંધા-૧]  
on dt. ૬-૧૦-૮૮

પુસ્તક ૧૫૩

(સંવિધાન)

આવક સુધારણાના યુગ્મ તરીકે જાણીતી સુધારણા

સુધારણાના ગ્રંથ સૂચ્ય પુસ્તક ગોંધાની બધી જ તરીકે;

કોઈ એ, કોઈ એ અને આગળ, પુસ્તકો જે તે તરીકે;

આવક-સુધારણા નીચેના કોઈ એના નામ ની. ૧૬૩.

પુસ્તક ૧૫૪

જે સુધારણા ગ્રંથ સુધારણાના ગોંધા પુસ્તકો,

જે સુધારણાના નામ પુસ્તકો ના ગોંધા પુસ્તકો;

પુસ્તકો જે તે પુસ્તકો અને સુધારણા કોઈ એના નામ,

પુસ્તકો નીચેના <sup>સુધારણા</sup> સુધારણાના સુધારણા. ૧૬૪.

પુસ્તક ૧૫૫

જે સુધારણા ગ્રંથ સુધારણા જે, સુધારણા જે સુધારણા,

પુસ્તકો નામ સુધારણા જે આ પુસ્તક સુધારણા;

પુસ્તકો સુધારણા કોઈ એ સુધારણા સુધારણા,

૨-૧૯૬૨ ની સુધારણાના ગોંધાના નામ સુધારણા. ૧૬૫.



(ବରାଣ)

୧୯୯୫:

ଧୂଳି କି ଅନିମାଣ ମଞ୍ଚ ଯୁକ୍ତ ଏ ମାମା,  
 ଅଧିକ ଯୁକ୍ତ ଅଧିକ ସଫଳ ଏ ମାମା, ଅଧିକ-ଅଧିକ ଅଧିକା;  
 'ଧୂଳି' ଅଧିକ 'ଂ' - ଅଧିକ କି ଅଧିକ କିଛି ଅଧି,  
 ଅଧିକା ଅଧିକାଧିକା ଅଧିକା ଅଧିକା ଅଧିକା ଅଧିକା ୧୯୯୫.

୧୯୯୬:

ଅଧିକାଧିକା ଅଧିକାଧିକା ଅଧିକା ଏ ଅଧିକ ଅଧିକାଧିକା;  
 ଧି ଅଧିକ ଅଧିକାଧିକାଧିକା ଧି ଅଧିକା ଅଧିକା ୧୯୯୬.

୧୯୯୭:

୦

ଅଧିକା ଅଧିକାଧିକାଧିକା ଅଧିକା ଅଧିକା ଅଧିକା ଅଧିକା;  
 ଅଧିକା ଅଧିକା ଅଧିକାଧିକାଧିକା ଧି ଅଧିକା ଅଧିକା ୧୯୯୭.

୧୯୯୮

(ଅଧିକା)

ଧିକାଧିକା ଅଧିକା ଧି, ଅଧିକା ଅଧିକାଧିକା,  
 ଅଧିକାଧିକା ଅଧିକାଧିକା ଅଧିକାଧିକା ଅଧିକା;  
 ଅଧିକା ଧି ଅଧିକା ଧି ଅଧିକା, ଅଧିକାଧିକାଧିକାଧିକା, ଅଧିକା,  
 ଅଧିକା ଅଧିକା ଧି ଅଧିକା, ଅଧିକାଧିକାଧିକାଧିକା ୧୯୯୮.

1993

(8/2/93)

2000 2000 2000 2000 2000 2000 2000 2000  
 2000 2000 2000 2000 2000 2000 2000 2000  
 2000 2000 2000 2000 2000 2000 2000 2000  
 2000 2000 2000 2000 2000 2000 2000 2000

1992

(8/2/92)

2000 2000 2000 2000 2000 2000 2000 2000  
 2000 2000 2000 2000 2000 2000 2000 2000  
 2000 2000 2000 2000 2000 2000 2000 2000  
 2000 2000 2000 2000 2000 2000 2000 2000  
 2000 2000 2000 2000 2000 2000 2000 2000

1994

(8/2/94)

2000 2000 2000 2000 2000 2000 2000 2000  
 2000 2000 2000 2000 2000 2000 2000 2000  
 2000 2000 2000 2000 2000 2000 2000 2000  
 2000 2000 2000 2000 2000 2000 2000 2000

ମୁମ୍ୱା ୧୯୯୫

(ପଞ୍ଚମ)

ଆମ ଦିନ ପାହୁଡ଼ାଲୋକ ଯାଏନା ଯାଏନା ଗୋଟିଏ ଲୋକ ଯାଏନା ଯାଏନା;  
ଅଧିକାରୀ ଗୋଟିଏ ଯାଏନା, ନିଜ ଯାଏନା ଯାଏନା ଗୋଟିଏ. ୧୯୯୫

ମୁମ୍ୱା ୧୯୯୬

ପାହୁଡ଼ାଲୋକ ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଗୋଟିଏ ଲୋକ ଯାଏନା ଯାଏନା;  
ଅଧିକାରୀ ଗୋଟିଏ ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଗୋଟିଏ. ୧୯୯୬

ମୁମ୍ୱା ୧୯୯୮

ଗୋଟିଏ ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା,  
ପାହୁଡ଼ାଲୋକ ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା;  
ନିଜ ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା,  
ନିଜ ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା. ୧୯୯୮

ମୁମ୍ୱା ୧୯୯୯

ନିଜ ଯାଏନା ଯାଏନା ଯାଏନା, ନିଜ ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା;  
ନିଜ ଯାଏନା, ନିଜ ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା;  
ନିଜ ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା,  
ନିଜ ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା ଯାଏନା. ୧୯୯୯

ଗୋଟିଏ ଯାଏନା ଯାଏନା

ગાંધી સંદેશ

(ફુગા ૧૦ & ૧૧૨)

પાઠ-૧

ફુગા ૧૦

(સંસ્કૃત)

પ્રજાસત્તા તત્ત્વના વાસ્તવિક સ્વરૂપને જાણવા માટે  
હૃદયને વિદ્યાર્થિના વાસ્તવિક પ્રજાસત્તા સ્વરૂપ વડે,  
કારણિક મોંઝા પાસેથી અનુભવિતપૂર્વક પ્રકાશને;

એ જ્ઞાનને ઉત્કૃષ્ટને આગળે રાખીને ~~પ્રજાસત્તા~~ <sup>પ્રજાસત્તા</sup> છે,  
જયવંતિ વાંચે જ્ઞાન પ્રકાશને જ આપી! તાત્કાલિક છે. ૧૦.

ફુગા ૧૧૧

(સંસ્કૃત)

પ્રજાસત્તા [આર્થિક] નીતિની હીના પદ્ધતિ પડતી વખતે,  
આવશ્યક આને ત્રણ ત્રણ વધારે સીમા હેઠળ વાંચે;

સાંસ્કૃતિક મત રહેતા આવા જગત આગળે,  
અત્યાચારના જાનક થવાને વાંચે - એ હીના વાં. ૧૧૧.

ફુગા ૧૧૨

(સંસ્કૃત)

જિજ્ઞાસુના જાનક થઈ પડતી વખતે આ મોંઝાને,  
સાંસ્કૃતિક મતના વાંચે આગળે સિદ્ધિ વાંચે;

જિજ્ઞાસુના વાંચે, ગુણવંતિ માટે તેને તેને જાણે,  
સાંસ્કૃતિક મતના વાંચે માટે તેને તેને જાણે વાં. ૧૧૨.

પુનઃ ૧૭૩ :

( સંસ્કૃત )

યે સોમો સુદૈન નોમી યાજ્ઞેભ્યં કો નચે,  
 યાજ્ઞેભ્યં નોમી સુદૈન નોમી, યાજ્ઞેભ્યં સુદૈન નોમી;  
 યાજ્ઞેભ્યં સુદૈન નોમી, યાજ્ઞેભ્યં સુદૈન નોમી,  
 યાજ્ઞેભ્યં સુદૈન નોમી, યાજ્ઞેભ્યં સુદૈન નોમી;  
 યે સોમો સુદૈન નોમી યાજ્ઞેભ્યં કો નચે,  
 યાજ્ઞેભ્યં સુદૈન નોમી યાજ્ઞેભ્યં સુદૈન નોમી. ૧૭૩.

પુનઃ ૧૭૪ :

( સંસ્કૃત )

યાજ્ઞેભ્યં સુદૈન નોમી યાજ્ઞેભ્યં સુદૈન નોમી,  
 યાજ્ઞેભ્યં સુદૈન નોમી યાજ્ઞેભ્યં સુદૈન નોમી;  
 યાજ્ઞેભ્યં સુદૈન નોમી યાજ્ઞેભ્યં સુદૈન નોમી,  
 યાજ્ઞેભ્યં સુદૈન નોમી યાજ્ઞેભ્યં સુદૈન નોમી. ૧૭૪.

પુનઃ ૧૭૫ :

( સંસ્કૃત )

યાજ્ઞેભ્યં સુદૈન નોમી યાજ્ઞેભ્યં સુદૈન નોમી,  
 યાજ્ઞેભ્યં સુદૈન નોમી યાજ્ઞેભ્યં સુદૈન નોમી;  
 યાજ્ઞેભ્યં સુદૈન નોમી યાજ્ઞેભ્યં સુદૈન નોમી,  
 યાજ્ઞેભ્યં સુદૈન નોમી યાજ્ઞેભ્યં સુદૈન નોમી. ૧૭૫.



પુનઃ ૧૯૬ (દરિયાબંધ)

ફરીથી ગુણિતી નરુદ્ધભુગુ, જે તા ગુણિતી નરુદ્ધભુગુ,  
 ને આત્મી આત્મીક છે, નેક જે ને ગુણિતી છે;  
 ગુણિતી નરુદ્ધભુગુ ગુણિતી, તા ગુણિતી નરુદ્ધભુગુ,  
 જે નરુદ્ધભુગુ યાન, નેક [ગુણિતી] ગુણિતી છે. ૧૯૬.

પુનઃ ૧૯૭ (દરિયાબંધ)

આત્મીક આત્મી આત્મી ત્રુદ્ધ ગુણિતી છે,  
 જે નરુદ્ધભુગુ આત્મી ગુણિતી ફરી તા ગુણિતી;  
 નરુદ્ધભુગુ આત્મી જે ગુણિતી નરુદ્ધભુગુ આત્મી છે,  
 જે ગુણિતી ગુણિતી ને નરુદ્ધભુગુ ગુણિતી છે. ૧૯૭.  
 જે નરુદ્ધભુગુ ફરી ગુણિતી ત્રુદ્ધ ગુણિતી યાન છે;  
 જે નરુદ્ધભુગુ આત્મી ગુણિતી ફરી તા યાન છે;

~~પુનઃ ૧૯૮~~

પુનઃ ૧૯૮ (દરિયાબંધ)

ગુણિતી ગુણિતી જે ગુણિતી છે આત્મી ગુણિતી,  
 આત્મી ગુણિતી ગુણિતી, ગુણિતી આત્મી ગુણિતી;  
 x ગુણિતી ગુણિતી ગુણિતી, ગુણિતી ગુણિતી ગુણિતી;  
 ગુણિતી ગુણિતી ગુણિતી ગુણિતી ગુણિતી ગુણિતી,  
 આત્મી ગુણિતી ગુણિતી ગુણિતી ગુણિતી ગુણિતી. ૧૯૮.

խոսք 956

( ԲՆՆՈՒՄ )

$f(x)$  և  $g(x)$  ֆունկցիաների արտադրյալի ֆունկցիաների\*  
 $f(x)$  և  $g(x)$  ֆունկցիաների արտադրյալի ֆունկցիաների\*  
 Այս արտադրյալի ֆունկցիաների արտադրյալի ֆունկցիաների\*

$f(x)$  և  $g(x)$  ֆունկցիաների արտադրյալի ֆունկցիաների\* արտադրյալի ֆունկցիաների\* 956

խոսք 960

( ԲՆՆՈՒՄ )

Բնական թվերի մասին օրինակների և ցուցանիշներ

$f(x)$  և  $g(x)$  ֆունկցիաների արտադրյալի ֆունկցիաների\* արտադրյալի ֆունկցիաների\*  
 $f(x)$  և  $g(x)$  ֆունկցիաների արտադրյալի ֆունկցիաների\* արտադրյալի ֆունկցիաների\*

Այս արտադրյալի ֆունկցիաների արտադրյալի ֆունկցիաների\*

Այս արտադրյալի ֆունկցիաների արտադրյալի ֆունկցիաների\* 960

խոսք 969

( ԲՆՆՈՒՄ )

Բնական թվերի մասին օրինակների և ցուցանիշներ

$f(x)$  և  $g(x)$  ֆունկցիաների արտադրյալի ֆունկցիաների\* արտադրյալի ֆունկցիաների\*  
 $f(x)$  և  $g(x)$  ֆունկցիաների արտադրյալի ֆունկցիաների\* արտադրյալի ֆունկցիաների\*

Այս արտադրյալի ֆունկցիաների արտադրյալի ֆունկցիաների\*

Այս արտադրյալի ֆունկցիաների արտադրյալի ֆունկցիաների\* 969

ਫੁਲ ੧੧੧ : (ਵਿਸ਼ਾ) :

ਜੇ ਆਪਣੇ ਪੜ੍ਹਨ ਨੂੰ, ਨਿਰਧਾਰਤ (ਮਿਤ) ਧਾਰਨ,

ਥੋੜੇ ਸਮੇਂ ਅਪਣਾ ਲਿਆ, ਨਹੀਂ ਤਾਂ ਨਿਰਧਾਰਤ ਧਾਰਨ;

ਅੰਤਿਮ-ਅੰਤਿਮ ਨਿਰਧਾਰਤ (ਮਿਤ) ਨਿਰਧਾਰਤ ਨੇ

ਪਾਠ ਪੂਰਾ ਪੁਰਾ ਆਪਣੇ ਨੇ ਫਿਰ ਨਿਰਧਾਰਤ ਨੇ. ੧੧੧.

ਫੁਲ ੧੧੨ : (ਵਿਸ਼ਾ) :

ਜੇ ਫਿਰ ਨਿਰਧਾਰਤ ਅੰਤਿਮ ਨਿਰਧਾਰਤ ਨੇ,

ਵਿਸ਼ਾ ਨਿਰਧਾਰਤ ਨੇ [ਅੰਤਿਮ] ਅੰਤਿਮ ਨੇ;

[ਅੰਤਿਮ] ਅੰਤਿਮ ਨੇ [ਅੰਤਿਮ] ਨੇ [ਅੰਤਿਮ] ਨੇ,

[ਅੰਤਿਮ] ਅੰਤਿਮ ਨੇ [ਅੰਤਿਮ] ਨੇ, [ਅੰਤਿਮ] ਅੰਤਿਮ ਨੇ. ੧੧੨  
[ਅੰਤਿਮ] ਅੰਤਿਮ ਨੇ [ਅੰਤਿਮ] ਨੇ, [ਅੰਤਿਮ] ਅੰਤਿਮ ਨੇ. ੧੧੨

ਜੇ ਫਿਰ ਅੰਤਿਮ ਨਿਰਧਾਰਤ -

(1) ગાંધીજીનાં અભિપ્રાય

૧) અભિપ્રાયોની ગાંધીજીનાં અભિપ્રાયોનાં ગુણોની પરીચયના:

(૧૯૨૦)

જોઈએ ત્યાં જાણીને જાણીને યાજી શકાય તે,  
જે જુદાં અભિપ્રાયો ગાંધી-મીઠાં દુર વાં યાજાય;  
પાણી અભિપ્રાય એ ભેદ જોઈ સુરક્ષા પુરવી અભિ!  
જોઈએ અભિપ્રાયો અભિપ્રાયો ગાંધીજી યાજી હશે. ૧૬૩.

જોઈએ અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો,  
અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો;  
અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો  
અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો. ૧૬૪.

જોઈએ એ જાણીને, જોઈએ અભિપ્રાયો અભિપ્રાયો,  
અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો;  
અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો  
અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો. ૧૬૫.

અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો,  
અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો;  
અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો  
અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો. ૧૬૬.

અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો,  
અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો;  
અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો  
અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો. ૧૬૭.

અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો,  
અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો;  
અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો  
અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો અભિપ્રાયો. ૧૬૮.

(ਫਿਰੋਜ਼)

ਅਤਿਅੰਤ ਚੰਦ੍ਰੇ ਤਰੀ ਅੰਨਮੋ ਗਾਗੀ,  
ਗੋਠੀਏ ਨੇ ਗੀਠੀ ਚਰ ਤਰੀ ਗੀ ਫੀ ਮੰਨੀ. ੧੯੯.

ਅੰਨਮੋ ਅੰਨੋ ਮੁੜ੍ਹੇ ਅੰਨੋ ਗੀ ਫੀ ਗੋਠੀਏ ਏ,  
ਨੇਹੀ ਗੀ ਫੀ ਗੋਠੀਏ ਗੀ ਫੀ ਫੀ;  
ਫੀ ਗੋਠੀਏ ਅੰਨੋ ਗੀਠੀ - ਮੁੜ੍ਹੇ,  
ਮੁੜ੍ਹੇ ਗੀਠੀਏ ਫੀ ਫੀ ਅੰਨਮੋ? ੨੦੦.

ਅੰਨੋ ਗੀਠੀਏ ਫੀ ਫੀ ਗੀਠੀ ਅੰਨਮੋ ਫੀ ਫੀ,  
ਗੀਠੀਏ ਏ ਗੋਠੀਏ ਗੀਠੀ ਗੀਠੀ ਫੀ ਫੀ;  
ਗੀਠੀ ਫੀ ਗੀਠੀਏ ਗੀਠੀ ਗੀਠੀਏ ਅੰਨੋ,  
ਫੀਠੀ ਅੰਨਮੋ ਗੀਠੀਏ ਗੀਠੀਏ! ਗੀਠੀਏ! ੨੦੧.

ਅੰਨਮੋ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਅੰਨਮੋ ਗੀਠੀਏ ਗੀਠੀਏ,  
ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ;  
ਗੀਠੀਏ! ਗੀਠੀਏ ਗੀਠੀਏ, ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ;  
ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ, ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ. ੨੦੨.

ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ,  
ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ;  
ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ;  
ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ;  
ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ;  
ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ? ੨੦੩.

'ਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ - ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ,  
ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ;  
'ਅੰਨਮੋ ਗੀਠੀਏ ਗੀਠੀਏ' - ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ  
ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ;  
ਅੰਨਮੋ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ,  
ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ ਗੀਠੀਏ. ੨੦੪

(ଉତ୍ତର)

ଓଢ଼ନ ନିଃସଂଖ୍ୟା ନାହିଁ - 'ଭାବନା ଭାବନା ଓ ଗର୍ଭା',  
ଭାବନା ନାହିଁ ଚାହିଁ ଉପାଦାନକୁ ଭାବନା;  
ଓ ଭାବନା ତା' ଗର୍ଭର ମିଶ୍ରଣ ଓ ଭାବନା,  
ଭାବନା ଓ ତା' ତାହା ମିଶ୍ରଣ ଧରା ପଣ;  
ମିଶ୍ରଣ ନିଶ୍ଚିନ୍ତାକୁ ନାହିଁ ଧରା ଉପାଦାନ,  
ତାହାକୁ ଧରା ଭାବନା, ନାହିଁ ନାହିଁ.

204.

ଭାବନାକୁ ଫି' ଭାବନା ତାହା ଶାନ୍ତି ଭାବନା,  
ନାହିଁ ତା' ଓ ତା' ତା' ତା' ଭାବନା ନାହିଁ;  
ଘରାଘରା ଭାବନାକୁ ନାହିଁ ଓ ଭାବନାକୁ,  
ତା' ନାହିଁ ଧରା ଭାବନା, ନାହିଁ ତା'.

205.

ଘରାଘରା ଗର୍ଭ ମଧ୍ୟ ଫି' ଭାବନା ପ୍ରାୟଶଃ-  
ଭାବନା ଧରା ଭାବନା ନାହିଁ ତାହା ତା' ଭାବନା;  
'ଫି' ତା' ଓ ଭାବନା ଓ ଭାବନା ତା' ଭାବନା,  
ଭାବନା ଚାହିଁ ଭାବନା ଧରା ଭାବନା ନାହିଁ.

209.

ଫି' ଭାବନା ଗର୍ଭ ପ୍ରାୟଶଃ ପ୍ରାୟଶଃ ଭାବନା ନାହିଁ,  
'ଭାବନା ଫି' ଧରା ଧରା ଭାବନା ଧରା' - ନାହିଁ;  
ଭାବନାକୁ ଭାବନା ଧରା ଭାବନା ଧରା ଭାବନା,  
ତାହା ଶାନ୍ତି ଭାବନାକୁ ନାହିଁ ନାହିଁ;  
ତା' ଧରା ଭାବନା ଧରା ଭାବନା ଧରା ଭାବନା,  
ନାହିଁ ଧରା ଧରା ଭାବନା, ନାହିଁ ନାହିଁ.

206.

ଧରାଘରା ଫି' ମଧ୍ୟ ଫି' ଭାବନା - ତା' ନାହିଁ,  
ଭାବନା ଭାବନା ଧରା ଭାବନା, ଭାବନା ଧରା ଭାବନା;  
ଧରା ପ୍ରାୟଶଃ ଭାବନାକୁ ଫି' ଭାବନା ଭାବନା,  
ଭାବନା ଭାବନାକୁ ଭାବନାକୁ ଭାବନା ଭାବନା;  
ଭାବନାକୁ ଭାବନାକୁ ଭାବନାକୁ ଭାବନାକୁ,  
ତା' ଭାବନାକୁ ଭାବନାକୁ ଭାବନାକୁ ଭାବନାକୁ.

207.

(કલ્પના)

સુખદેવ-કલ્પના એ ત્રણ-ત્રણ બાજુ ભાગે છે,  
જાણ્યું નથી અત્યુભાગ્યે ત્રણ-ત્રણ કાંઈ છે. 290.

પરિભાગ એ ને ત્રણ છે (ભાગ્યવતી) એ વાટે નથી  
પરિભાગ. કાલ્યાણીય પરિભાગ નથી એમ એ વધી;  
એક ત્રણ છે ત્રણ ભાગ, એ અત્યુ ત્રણ તુરુરુ સા;  
જાણ પરિભાગરૂપ ત્રણ ત્રણ રૂપ અત્યુ રૂપ. 291.

શાંતિ રૂપ રૂપ રૂપ એ એક અત્યુ રૂપ છે,  
ને કાલ્યાણીય ગાંધી ગાંધી, પદ્મ સા રૂપ;  
એક એક અત્યુ ભાગ ત્રણ એક અત્યુ પ્રવેશી,  
જાણ જાણ રૂપને રૂપ એ અત્યુ ભાગ એ જાણી;  
ગાંધી એ નામ સા સા જાણ રૂપને રૂપ એક એક  
એક કાલ્યાણીય એક સા ત્રણ નામ એ એક! 292.

એ ગાંધી એક અત્યુ એક અત્યુ એક એક,  
એક એ ત્રણ અત્યુ એ ને, ને એ અત્યુ એ વાટે;  
એ જાણ એક રૂપ રૂપ ને ગાંધી પરિભાગ  
ભાગે ભાગે ત્રણ રૂપ, ત્રણ એક ત્રણ રૂપ એ. 293.

'પરિભાગ એ જાણ એ એક અત્યુ પરિભાગ ત્રણ  
ત્રણ નામ ત્રણ છે - જાણ એ જાણ જાણ જાણ;  
નામ જાણ એ ગાંધી ત્રણ રૂપ ભાગે એક,  
એ એક રૂપ ત્રણ અત્યુ પરિભાગ. 294.

રૂપને જાણ જાણ એક ત્રણ જાણ રૂપને એક  
જાણ જાણ એ એક એક છે, જાણ ને પરિભાગ -  
એક એક રૂપ પ્રવેશી ત્રણ એક જાણ ને એક  
એ જાણ એક એક ને જાણ એ જાણ વાટે;  
ને 'જાણ રૂપને જાણ' - જાણ ગાંધી એક જાણ,  
જાણ કાલ્યાણીય એક રૂપને એક જાણ એક એક? 295.

(કેલિગ્રાફ)

ત્રિજગતમાં ફેલાયેલું પદ્ધતિને તેની તરીકે જાણ થી  
જાણી શકાય તેવું સુખાનુજી, ન સુખાનુજી થી પદ્ધતિને ;  
જ્યોતિષના નામ જિજ્ઞાસુ તરે પણ પૂરેલા તેની શાખા જા,  
સુખ જાગ જાણે સુખને પણ સુખ જાગજી શાખા જા. ૨૧૬.

આ સૂક્ષ્મ સ્વામી-સુખાનુજી જિજ્ઞાસુ શાખા જાણે જાણી,  
જાગ સુખ સુખાનુજી ન શાખા, જાગ જાગજીને જાણી;  
અજાણતાય હરે તરી આ જાગ જાગજીને જાણે,  
અજાણતાય નામ-અજાણતાય પૂરેલા સુખાનુજી પૂરેલ શાખા. ૨૧૭.

અજાણતાયથી સ્વામી-સુખાનુજી પદ્ધતિને જાગ આ,  
પણ ફેલાયેલેલા શાખા, ન સ્વામી-સુખાનુજી તરે જ જાણી;  
સુખાનુજી જાગ તરે સ્વામી-સુખાનુજી નામની શાખા જાણે,  
જાણે પૂરેલા અજાણતાય પૂરેલા જાગે આ જાગજીને પૂરેલ શાખા. ૨૧૮.

જાગજીને શાખાને ન જાગજીને અજાણતાય શાખાને -  
જાણે ફેલાયેલેલા જાગ આ જાગજીને સ્વામી-સુખાનુજી;  
આ જાગજીને જાગ જાગજીને જાગજીને જાગ જાગ જાગજીને,  
અજાણતાય પૂરેલા અજાણતાય જાગજીને પૂરેલા શાખા. ૨૧૯.

અજાણતાય જાણે જાગજીને જાગજીને શાખાને શાખા જાણે,  
પદ્ધતિને જાણે શાખાને જાણે, પણ સુખાનુજીને અજાણતાય જાણે;  
અજાણતાય જાગ જાગ જાગજીને - જાગજીને જાગજીને જાગજીને  
અજાણતાય જાગ જાગ જાગજીને, જાગજીને જાગજીને જાગજીને. ૨૨૦.

સ્વામી-સુખાનુજી જાગજીને પદ્ધતિને જાગજીને જાગજીને  
જાગજીને જાગજીને જાગજીને, જાગજીને જાગજીને જાગજીને. ૨૨૧.



( ८६/२०१० )

ਏ ਪੁਰੀ, ਕੋਟ, ਕੇਤੂਨ ਚਲੀ ਏ ਗੁਰੀ ਕੀਯੋਂ ਤਾਨ ਨੇ,  
ਮਠੇਰਾ ਠੇਲੇ ਏ ਭੇਰੇਗੇ, ਨੇ ਕੋਟ ਗਠਾਗਠਾ ਏ ;  
ਠੇਰੇ ਖਿਫ਼ਾ ਨੇ ਖਾਨੀ ਠੀ ਠੇਰਾ ਤੋਪ ਪਈਏ,  
ਠੇਰੇ ਖਿਫ਼ਾ ਠੇਰਾ ਖਾਨੀ ਠੀਫ਼ਾ ਠੀਫ਼ਾ ਪੁਰੀਫ਼ਾ ;  
ਠੇਰੇ ਖਿਫ਼ਾ ਤਾਨ ਠੇਰੇਗੇ ਨੇ ਪਠੀ ਠੇਰੇਗੀ ਠੀ,  
ਠੇਰੇ ਠੇਰੇ ਠੇਰੇ ਠੇਰੇਗੇ ਤਾਨੀਫ਼ਾ ਠੀ ? 222.

ਠੇ ਤਾਨੀਫ਼ਾ ਠੇਰੇਗੇ ਠੇਰੇ ਤਾਨੀ ਠੇਰੇਗੇ,  
ਠੇ ਠੇਰੇ ਠੇਰੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇ ਠੇਰੇ ਠੇਰੇ ;  
ਠੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇ ਠੇਰੇ ਠੇਰੇ ਠੇਰੇ ਠੇਰੇ,  
ਠੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇ ਠੇਰੇਗੇ ;  
ਠੇਰੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇ ਠੇਰੇਗੇ,  
ਠੇਰੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇ ਠੇਰੇਗੇ. 223.

ਠੇਰੇਗੇ ਠੇਰੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ,  
ਠੇਰੇਗੇ ਠੇਰੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ;  
ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ,  
ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ. 224.

ਠੇਰੇਗੇ, ਠੇਰੇਗੇ, ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ,  
ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ, ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ;  
ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ,  
ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ. 225.

ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ;  
ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ. 226.

ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ;  
ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ. 227.

ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ;  
ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ ਠੇਰੇਗੇ. 228.



( ୧୨୦୦ )

କେ ମିତ୍ର ଏ ପୂର୍ବରୁ ନି ନିଧନ ଏ ନିକଟୀ ଭାବେ  
ଏବଂ ପୂର୍ବ ପୂର୍ବରୁ, ପ୍ରାଣ-ଦାୟକ ଚଳି ତଃ;  
କି କିମ୍ପା ଦାୟକ ନିଧନ ଭାବେ ଏ ନିକଟରୁ,  
କିମ୍ପା ନିଧନ-ଦାୟକ ଭାବେ କିମ୍ପା ନିଧନ ଦାୟକ  
ନିଧନ ପ୍ରତି ତଃ ଗୁଣିତରୁ ନିଧନ  
କି ପୂର୍ବରୁ ପ୍ରାଣରୁ ନିଧନ ଦାୟକ ତଃ. ୨୩୫.

କିମ୍ପା ନିଧନରୁ କିମ୍ପା ନିଧନ ତଃ ନିଧନ ପ୍ରାଣ,  
-କିମ୍ପା ତଃ ନିଧନ କିମ୍ପା ନିଧନ ନିଧନ ପ୍ରାଣ କିମ୍ପା;  
କିମ୍ପା ଗୁଣିତରୁ କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ,  
କିମ୍ପା ପ୍ରାଣରୁ ନିଧନ ନିଧନ କିମ୍ପା କିମ୍ପା ପ୍ରାଣରୁ କିମ୍ପା. ୨୩୬.

ପୂର୍ବରୁ କିମ୍ପା ନିଧନରୁ କିମ୍ପା ନିଧନ କିମ୍ପା,  
କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ 'କିମ୍ପା ନିଧନ କିମ୍ପା' ୨୩୭.

କିମ୍ପା ନିଧନରୁ କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ,  
କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ. ୨୩୮.

କିମ୍ପା ନିଧନରୁ କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ,  
କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ କିମ୍ପା. ୨୩୯.

କିମ୍ପା ନିଧନରୁ କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ,  
କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ କିମ୍ପା;  
କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ କିମ୍ପା,  
କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ. ୨୪୦.

କିମ୍ପା ନିଧନରୁ କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ,  
କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ କିମ୍ପା;  
କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ କିମ୍ପା,  
କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ କିମ୍ପା;  
କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ କିମ୍ପା,  
କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ କିମ୍ପା ନିଧନ କିମ୍ପା. ୨୪୧.

(8/20/00)

સુવર્ણચંદ્રે સજી સર્વે વચનલેને તેણી ભાભી,  
નૃપેશ સર્વે, ગુણવચન ગુણવચન યુગ્મી ભાભી. 202.

દેવલોકીને સખતરણ જે સર્વે ને સખલેણે છે,  
નેણી સખતરણ સખતરણ સર્વે દેવલોકીને મને સર્વે;  
સુવર્ણચંદ્રે દેવલોકીને ને વચનવચન છે,  
સુવર્ણચંદ્રે સર્વે મને સર્વે સખલેણે છે. 203.

ભાભી ધાભી, ભાભી ધાભી ભાભી - ભાભી છે,  
ભાભી સર્વે તેણી સર્વે સખતરણ સુવર્ણચંદ્રે;  
સુવર્ણચંદ્રે સર્વે સર્વે સર્વે છે સખતરણ મને જે,  
નેણી સર્વે જે સર્વે સુવર્ણચંદ્રે સર્વે મને. 204.

સુવર્ણચંદ્રે સખતરણ યુગ્મી સર્વે સર્વે;  
સુવર્ણચંદ્રે સર્વે સર્વે સર્વે મને સર્વે. 205.

ધૃતિ સખતરણ જે મને સુવર્ણચંદ્રે સર્વે સર્વે સર્વે;  
જે સર્વે, સર્વે, સર્વે, સર્વે, સર્વે સર્વે છે. 206.

સુવર્ણચંદ્રે સખતરણ યુગ્મી સર્વે સર્વે સર્વે

૧/૨/૨૧૬૨

(દેવગી)

૨-ચાંદુવાદની નિદેશનાની વિચિત્ર ને સૂચે છે,  
સાચે તરીકે વિચારવા વાતુભવવચીતે વિષે;  
ઉપર ને ઉપર ઉપે ભાવ સર્વે જ જાગતાં,  
જે રીતે યત્ને તે પાત્ર વિચારીયું તરીકે જરૂર. ૨૨૭.

જેને સમજાવવાને વાગે છે તેમજ વાતુકાં ઉપે,  
નિજની પ્રાગ્ન સંચારી રૂપે જે ભાગે પાત્ર;  
પરંતુ જ છે વિચાર જેને કાંઈ જાગ પશુ સમુ  
તે જાણી પાત્રે છે, પરંતુ જાણ ૨-ચાંદુવાદી નભું-  
જે હોય નહીં તે સમજાવે નહીં હોય' કાંઈ જાણીને,  
નિજ જાગણના ભાગે સમજાવે પાત્રે ઉપે. ૨૨૮

'આ ભૂલ સમજી જાગ છે' - કોઈનાવી વિચારને,  
નિજ ભાગની સમજાવે છે, વિચારને જુદે તે કાંઈ  
પશુકાં તરીકે સમજાવે; પરંતુ ૨-ચાંદુવાદી તે કાંઈ!  
'જે હોય નહીં નિજ સમજાવે પાત્રે તરીકે નહીં હોય જા -  
જેને જાણીને પાત્રે તેમજ ભાવ જે પાત્રે કાંઈ,  
તે સમજાવે જાણે રીતે નિજ સમજાવે છે કાંઈ. ૨૨૯.

કોઈનાવીપણ્યું છે જાગને તેને જુદે તે સમજાવે,  
તે 'સમજાવે કાંઈ જુદે કાં જાગને સમજાવે તરીકે' -  
જેને જાણીને કોઈનાવી જાણે પાત્રે તરીકે,  
પણ ૨-ચાંદુવાદી તે ઉપે નિજ કાંઈ જુદેના વા  
જાણી કાંઈ સમજાવે તરીકે જાણે મુજબ મહેતો,  
જે કાંઈ છે, નિજાણે છે તરીકે સમજાવે તેને. ૨૩૦.

કોઈનાવી સમજાવે કાંઈ જુદે તરીકે  
જાણે સમજાવે, જાગને પ્રકાશને સમજાવે તરીકે;  
કાંઈ કાંઈ જ જુદેના તે જાણે જાણે નભું તરીકે,  
૨-ચાંદુવાદી તે 'કાંઈ જુદે પાત્રે' - જાણે પાત્રે;  
કાંઈ જાણે છે તે જાગ. જે વાતુકાં તેને ભાગે  
જેને જાણીને તે જાગ. જાણે જાગને જ સમજાવે. ૨૩૧.

(સરિગીત)

પુલકી કાલિભાગ પડેલાં પુગર રેકર દેખાતે,  
 સોતેલી આગની જાણે તે દેખાતે જિજ દેખાતે;  
 તેજી દેખતે ઝૂલ્ય તેને ગણી જિજ કાલિભાગને,  
 રૂઝાદવાલી ને કાલિભાગને જિજ કાલિભાગ કાલિભાગને  
 ઝુટીને રાદ, તેજી ધારના ઝુટી ટાગ પાટીએ,  
 ધણ પૂર્વરૂપે જાણતે - તેજી ગણીને પાતે ગણે. ૨૫૨

વાલિન દેખતે જુલકી કોતેલી કોટાલી રાદે,  
 'જિજ કાલિભાગ ઝુલકીભાગ છે' - માલકાત કોલ દેકે;  
 જિજ દેખ તેજી જાલિન દેખ બિજાન ને પડનાં તે,  
 રૂઝાદવાલી ને 'જુલકી દેખાતે કાલિભાગ છે પડેજી' પડે -  
 વાલિન કાલિભાગ, વાલિ રાદા જાલિન માલકાત કાલિભાગ  
 વાલિ ઝુલકીજાલ નામે રાદે! જિજ દેખાતે કાલિભાગ તે. ૨૫૩.

પડકીરનાં વાલિન પડેલાં જાલિન ટાલકી રાદે,  
 રૂઝાદવાલી જિજ પુલકીને કાલિભાગ નામે જે દેખાતે;  
 'જિજ કીરનાં કાલિભાગ રાદે કાલિભાગ નામે - વાલિ માલકાત  
 કોતેલીને રાદ દેખતે, પડેજી રૂઝાદવાલી ને રાદે!  
 'જિજ કીરનાં જે વાલિન વાલિન રાદે જાલિન કાલિભાગ  
 કાલિભાગ રાદે 'જિજ કીરનાં' - વાલિ માલકાત રાદે રાદે દેખતે. ૨૫૪.

'રૂઝાદવાલી વાલિન પડકીરનાં નામે જુલકીને જિજ કીરનાં'  
 - વાલિ માલકાત કાલિભાગ વાલિ રાદે, વાલિ રૂઝાદવાલી  
 કાલિભાગ નામે ને વાલિ ને તેજી જુલકીને રાદે રાદે!  
 વાલિ રાદા રૂઝાદવાલી રાદે જિજ કીરનાં નામે પડે  
 'પડકીરનાં કાલિભાગ માલકાત તેજી રાદે રાદે,  
 વાલિ ને વાલિને કાલિભાગ રાદે - તેજી જુલકીને રાદે રાદે. ૨૫૫.

' ଧୂଳି ଭାଙ୍ଗିଲାନି ଏହିପରି ବାଣୀ ଘୋର ଭାବେ ସାଧନ,  
 ସିଂହ ଗଠି ଚାରି ଥର ପାଠ - କିମ୍ପାଣୀ କି ମାଧ୍ୟମ;  
 ମାଣି ଭାବେ ଥାଉଣି ଭାବି ଶୁଣି ଗୁଠି ପଢ଼ି ଦିଅନ୍ତି,  
 ଭାବଣୀ ସାଧି ବାଣୀ, ଏହି ସଂସ୍କୃତି. ଶାସନ -  
 ' ଭାବଣୀ ଗୁଠି ଭାବଣୀ ଏ ଶାସନ ଗୁଠି ଗୁଠି,  
 ଏହିପରି ଶାସନ ଗୁଠି ଗୁଠି, ଥାଉଣି ଧୂଳି ସଂସ୍କୃତି. ୨୫

' ଏ ଥାଉଣି ଭାବଣୀ ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଏ ଥାଉଣି ଗୁଠି '  
 - ଶାସନ, ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି;  
 ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି;  
 ଏହି ସଂସ୍କୃତି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି;  
 ' ଏହିପରି ଗୁଠି ଗୁଠି ଗୁଠି - ଶାସନ, ଗୁଠି ଗୁଠି  
 ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି. ୨୬.

' ଏହିପରି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି - ଗୁଠି ଗୁଠି,  
 ଭାବଣୀ ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି;  
 ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି,  
 ଭାବଣୀ ଗୁଠି ଗୁଠି, ଏହି ସଂସ୍କୃତି ଗୁଠି ଗୁଠି;  
 ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି,  
 ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି ଗୁଠି. ୨୭.

(સરિગીત)

‘એ સર્વ પરમાત્મરૂપે આ આત્મા? ત્યમ માનીને,  
યદં ચ્યુત મુક્ત સ્વભાવથી અમરની એકોત્તી અરે;  
પરમાત્મા સ્વચંદ્ર યદં નિર્ભયપણે કીડા કર,  
સ્થાવરો તો નિરતમાત્મા અચંત આરૂઢ યદં પરે  
પ્રારૂપ્યના ભાવોરૂપ આત્માનથી’ - ત્યમ માનો,  
નિષ્કેપરૂપ પ્રવર્તનો, યદંને વિચ્યુક્ત વિચારનો રખે.

ઉભાદે વ્યય લક્ષિત એવો જ્ઞાનના અંશો વળે,  
ને દેખી અમરની અનિત્ય એ સર્વથા આત્મા? - કરે;  
કાણાંકો સંગે ખતિત યદંને માશ તો પાને અન  
સ્થાવરો તો એવન્યવસ્તુ નિત્ય-ઉદિત અનુભવે;  
દેકોત્તીથી સ્વભાવ દાન છે જેમના મરિના, પરે,  
અ સાવરૂપ પ્રવર્તનો ક્યાની સદા જવના રહુ. ૨૬૦

દેકોત્તીથી વિચ્યુક્ત એ આ જ્ઞાનનો ફોલાવ જે,  
આકાર ભર એ એક એવો આત્મા, આશા ભડ  
નિર્ભય પરિણતિથી જુદો, અમરની વચ્ચે આત્માને;  
સ્થાવરો તો અિદવસ્તુની વૃત્તિ તણા કમળી પરે,  
‘એ જ્ઞાન રૂપ નિત્ય પણ છે અનિત્ય, પરિણતિને લીધે’  
- ત્યમ માની નિત્ય-અનિત્ય એવો જ્ઞાન જ અમરુત ૨૬૧

બસ જ્ઞાનમાત્ર જ આત્માનું અનુકોણસ્વરૂપ જે  
સાદુ જ્યને સ્વચાત્રે આ રીતે સ્થાદપાદ પ્રગટ કર રહુ

સ્થાવરરૂપ અલંકૃત નિમ્બરૂપિત શાશન આ રીતે  
નિદિત ફલુ સ્થપિત યદં સત્યાર્થ વસ્તુસ્થિતિ વે રહુ

હું ત્યાદિ શાકિ અનુકૂળી સુચીને ભરતો રો ભલે,  
જ જ્ઞાનમાત્રમથીપણાને છોડતો ન કરી પરે;  
પૂર્વકો રીતે કમ અન અમરરૂપ વર્તે સદા,  
તે રૂપને પરધમ્ય અિદવસ્તુ છે આ ભાવો ૨૬૨



(पुत्रिणी)

आ वस्तुतः व्यवस्थिते अथवातेव आनी हेमीने  
नेडाल-संगत दृष्टिणी, अथाकाद-शुद्धि जालीने;  
जिमेव तली नीतिने नली वेओ इहीय इत्येवता,  
त सत्पुरुषो आनी सत्पुरुषाण्य सध चला २५४

जे पुरुष इध परा शीते दूरे इहीने मोएने,  
निज सावसात्र अर्कप लूमिने सध आकाय इरे;  
साधइपणान पातीने ते नर्य सिध्येशा लरे;  
परा लूमि आ नरि पातला ते पूठ संसार लगे २५५

अथाकादमां डोशाल्य ने संयम-सुनिध्यवता वडे,  
निजमां शी उपपुष्टा ने निजलायता निजनी इरे;  
आ शीव साधे इपावतेम सिध्या तली जे मीतीने,  
निजलायतय आ लूमिडाना पुरुष त आकाय इरे. २५७.

पुर्वोक्त शीते जे पुरुष आ लूमिने आकाय इरे,  
तेनच आवो आतमा आ उदयेने पागे परे -  
यित्पुंजमा विडासइप छे पीलपुं नेनुं अन  
अत्यंत अक्ष्य प्रकाश नेनो सुप्रमाण समान छे;  
आनेदमा स्थित जे सत्पुरुषीने सधयेअपुं जे  
अस्मदित नेनुं इप छे ने अस्मदनेनी ज्योति छे. २५८

अथाकादयी जे हीपर उगमा तेच छे नेनुं अने  
मरिमा विशुद्धस्वभावरूप, अयो प्रकाश उदित मन;  
त्या अंधमोहिनीं धनारा अत्य लाया ना धन,  
नित्यादयी इवळ स्वभाव स्फुरायमान मनएने. २५९

(૨૨મી)

અનેકવિદ્ય નિજશક્તિના સમુદાયનયુ આ આત્મા,  
નયરૂપિની પાંડિત્ય યદને જાણ પાત આત્મા;  
તેથી અનુભવ હું કરું - પાંડો નિરાદૃત\* જા ભલે,  
તોય અપાંડિત પૂર્ણરૂપે છે, સ્વરૂપ જે હું પારે;  
જે અંક છે ન શાંત અંકાંત સ્વરૂપ છે મરુદું,  
બી આચાર છે તેહું અપ્પા! એતન્યમય હું તેજ છું. ૨૭૦

\* નિરાદૃત = બરિષ્ઠવ; દૂર; રદભાવ; નાકબૂલ.

હું જ્ઞાનમત્ર જ ભાવ છું, જાણનશિયા મુજ સ્વરૂપ છે,  
તેને કદી પરચેના બસ જ્ઞાનમત્ર ન જાણવો;  
પણ અપેચના આકારરૂપે જ્ઞાનકલ્પભાગે ઊઠે,  
તે રૂપ પરિણામો થકા હું અપેચ-જ્ઞાતા-જ્ઞાન છું ૨૭૧

મુજ તત્વનો જ સ્વભાવ એવો અનેકાંતસ્વરૂપ છે,  
દેખાય તે મેમક, ઉભય બધી અપેચક દેખાય છે;  
જો પણ પરસ્પર ત્રિલિપ શક્તિ સમૂહરૂપ ન શકુરે,  
જે શુભભુષિવંતના મનને વિમોહિત ના કરે. ૨૭૨

અદ્ભુત સ્મુજ વૈભવ અપ્પા! આત્મા તણો આલોખરે,  
દીસે અનેકરૂપે તથા તે અંકચંતા ધારણ કરે;  
દીસે કાલિક તે અંક શીત, ધ્રુવ અંક શીતે દીસે,  
દીસે પરમવિસ્તૃત તે બધી નિજ પ્રદશોમાં વસે. ૨૭૩

દીસે કષાયો અંક શીતે, શાંતિ અંક શીતે દીસે,  
ભાવદુઃખ દીસે અંક શીતે, અંક શીત મુકિત અપરે;  
દીસે ત્રિલોક શકુરે તથા એતન્ય શાંતે અંકલા, ૨૭૪  
જય હો અપ્પા! અદ્ભુતથી અદ્ભુત આત્મસ્વભાવના.

(સ્વચિંતા)

ત્રણ લોક ધાર્યે મન એવો તેજસ્વી પુંજ જે,  
જેનાં દીસે જોઈએ એનેક તથાપિ એકચરુપ જે,  
તત્ત્વોપલબ્ધિ અધિન છે, નિષ્કંપ જ્યોતિર્મય છે,  
એતન્મનો અનકાર આ જ્યવંત વર્તે છે પરે ૨૭૫

જે અમલી એતન્રુપ આત્માને જ નિજ આત્મા લે,  
આત્મા મ્હી અવિશાપણ શામે નિમગ્ન સદાય ને ;  
નિમેદિ, નિર્મલ પૂર્ણ જે, પ્રતિપક્ષી કર્મ નરિ અરો!  
આ ઉદિત અમૃતચંદ્રજ્યોતિ સર્વ શીત પ્રકાશનો ૨૭૬

પરને સ્વયં સૌથી પ્રથમ થયું એવે જે અમાનવી,  
તે એવે ધાર્યાં સ્વરૂપનાં અંતર પડ્યું જેના થકી ;  
અંતર ધાર્યાં જેનાથી બુદ્ધિદેહ રાગ-લેષ ગ્રહણ થયાં,  
જેનાથી કારક ઉપજ્યાં, અનુભવિત્યુ કૃપી ભોગ્યાં,  
વિચારધના આદિનાં થયું મન તે અમાન જે  
તેથી નથી કંઈ પણ પુને, એ ભાવ પાખ્યાં વિલખને ૨૭૭

વસ્તુતણા સાચા સ્વરૂપને સુરીને જોઈને કર્યું,  
આ સમયની વ્યાધ્યા તણુ કરાવણુ એ શબ્દનું,  
તથી કંઈ પણ કરવે અમૃતચંદ્ર સુરિયું તેડેનાં,  
છે ગુણ જે નિજના અમૃતિક જ્ઞાનમાત્ર સ્વરૂપનાં ૨૭૮